


॥ तस्य वाचकः प्रणवः ॥

# ऋतमसरा

आत्मनो हिताय जगातः सुखाय



‘योग’ लिक्षा लावीओ, ‘लिक्षु’ बनी गुरुद्वार;  
मुमुक्षु जड़त पामशे, सौनो मुजमां भाग.

॥ॐ॥

॥तस्य वाचकः प्रणवः॥

## ગુરુપૂર્ણિમા મહોત્સવ

સદ્ગુર્પ્રેરી શ્રી...

પરમગુરુ ઓમ પરમાત્માની દૃપાથી અને પ.પુ. ગુરુદેવ શ્રી યોગભિક્ષુજીના આશીર્વાદ્યી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવાનું નિયરિબ છે. તે જે દિવસે 'કરું અમૃત' (આવૃત્તિ ત્રીજી) પુસ્તકનું વિમોચન પાગ થશે.

સર્વે ગુરુપ્રેરીઓ, સદ્ગુર્પ્રેરીઓ તથા સમસ્ત ઓમ પરિવારને આ મહાર્યાનો લાલ લેવાનું હાર્દિક આમંત્રાગ છે.

સમય : સવારે ૭=૦૦ થી ૩=૦૦ સુધી

તારીખ : ૩૦-૭-૯૬ ને મંગળવાર

સ્થળ : ઈચ્છાબેનની વાડી,  
પુણ્યકુંઠ પાસે, કાંકરીયા,  
મહિનગર,  
અમદાવાદ - ૩૮૦૦૨૮.

કાર્યક્રમ આયોજિતોના,  
૭૨૫ નારાયાગ,  
૭૨૫ ઓમ ગુરુદેવ.

## ऋतम्भरा

**(ऋतम्भरा एटले अनुभवयुक्त सत्यथी भरेलुं)**  
**(बहुजनहिताय - बहुजनसुखाय)**  
**जुलाई - ओगस्ट - सप्टेम्बर (त्रिमासिक)**

VOL - VI ( 96-97 )

ISSUE - I

मानदंतंत्री - वैष्णव व्यास

## शांता

**(पातंजल योगदर्शन - साधनपाद)**

-योगलिङ्ग

पतंजलिमुनिचे साधनपादमां आणोग्योगनां प्रथम पाच अंगोनुं- पम (अदित्या, सत्य, अस्तेय, भ्रह्मवर्य अने अपरिच्छद), नियम (शीथ, संतोष, तप, स्वाध्याय अने इच्छप्रणिपान), आसन, प्राणायाम अने प्रत्याहारानुं- वार्गन क्रेतके. आणोग-योगनां आ पाच अंगो बहिर्घोषी कुडेयाप छे. बाडीना वारु अंगो - धारणा, ध्यान अने समाधि अंतर्दर्भंगो छे.

धारणा, ध्यान अने समाधिनो समावेश पतंजलिमुनिचे विभूतिपादमां क्यो छे. डारागडे धारणा द्वारा विभूतिअोनी प्राप्ति धाय छे. ध्यान अने समाधि पागु अेक महान विभूति छे. 'स्वदृपमां स्थिर धरुं' तेनाथी बोळ दोई भोटी सिद्धिनव्या, विभूतिनव्या. अने स्वदृपस्थ, समाधिद्वारा धर्त शक्तय छे. स्वदृपस्थ धरुं तेनु नाम न समाधि छे.

धारणा, ध्यान अने समाधि विभूतिपादमां आपतां दोवा धतां तेने साधनपादमां न समाज लाई छाऊं. लेव्हा अप्टांगयोगना साधकने-विक्षासुने-पाचकने आणे अंग वाचवानो-समजवानो लाल मणी शेके. तेमने जोम न लागे के पोगदर्शन वाचवानं अपुरुं रही अगुं.

**विभूतिपाद (त्राण सूत्रो )**

विभूतिपादनुं प्रथम सूत्र छे -

देशबन्धप्रियतस्य धारणा ॥ १ ॥

**भावार्थ :** वित्तने (दोई अेक) देशमां बांधी देवुं तेनु नाम धारणा.

**विस्तार :** शरीरना औदरना अथवा शरीरना अदारना

दोई अेक देशमां, स्थानमां वित्तने बांधी देवुं, वित्तने स्थिर करी देवुं तेनु नाम धारणा छे.

धारणाने मानसिक नाटक करी शकाय. नाटकमां चर्मचतुओ दारा दोई अेक वस्तुने अपवड जेवानी दोय छे. मानसिक नाटक अेके दोई वस्तुने, के दोई आइतिने अंग चक्षुओ, सूक्ष्म आंगोधी उल्पनानी दण्डियी जेवी ते. स्थूल नाटक अपोगरीते धाय तो आंगो नबणी पाए अथवा आंघणा धाय. न्यारे मानसिक नाटकमां आवो दोई अप नही.

धारणानो आ प्रकार अति भरण, सो समाज शके तेवो अने समाजने प्रयोगात्मक्षेत्रे डरी शकाय तेवी रीते जलायवानो प्रयत्न उरवामां आयो छे. शरीरमां न्यां पाग मानसिक नाटक उरवामां आये छे तां वतान्मोऽग्ना प्रमाणमां पागु अने वृत्तिनो पागु स्थित-स्थिर धर्त जाय छे.

तत्र प्रत्येकतानता ध्यानम् ॥ २ ॥

**भावार्थ :** तेमां (धारणामां) एकतानता तेनु नाम धान छे.

**विस्तार :** मानसिक नाटक करता दोईये अर्थात् दोई आइतिने दोई देशमां उल्पीने मानसिक चक्षुधी जेवा दोईये न्यारे धोडी धार तो ते आइति देखाय पागु पाँडी तुरत न बीनुं करी देखावानु शङ धर्त जाय. नक्की कुरेल आइतिने जेवानो प्रयत्न उरवाये अने धोडी न धारमां बीनुं देखाया लागे तां सुमो ते धारणा कुडेयाप छे. पागु न्यारे तेमां एकतानता आवो अप अर्थात् नक्की कुरेली आइतिने दुच्छा दोप तां सुमो मानसिक चक्षुओ दारा जेई शक्कीये, पर्यंत वर्च्ये

બીજુ આકૃતિ ઉપરે જ નહીં, દેખાય જ નહીં તેવી સ્થિતિને ધ્યાન કરું છે. અસ્તુ.

ધ્યાન એ કોઈ સહેલો વિષય છે? અધ્યાત્મયોગનું સાતમું અંગ તે ધ્યાન, અને તેના પછી સમાપ્તિ. ધ્યાન અને સમાપ્તિ, એ બનેમાં કંઈ હરક જ નથી; કેવળ માત્રાનો જ હરક છે. જીવારે ધ્યાન ગાહ અવસ્થાએ, પ્રગાહ અવસ્થાએ પડોયે, અતિશય ઊંડુ ઊતરી જવાય લારે તેને સમાપ્તિ કહેવામાં આવે છે. સમાપ્તિ ઉપરછલ્લી હોય ન્યારે એ જ ધ્યાન છે. મહાત્માનો કહે છે કે ધ્યાન કરો, ધ્યાન કરો; લોકો કહે છે કે ધ્યાન નથી વાગતું, ધ્યાન નથી વાગતું. ધ્યાન લાગે કઈ રીતે? ધ્યાન કરવું કઈ રીતે? સીધા જ મેટ્રિકમાં બેચી જઈએ તો જમે એટલાં વર્તે કે જમે એટલા જન્મે પાણ પાસ થઈએ? પ્રથમ પગવિયેદી જ ચઢવું જોઈએ. સીધિસીધા જ ધ્યાન-સમાપ્તિનું અંગ પડીને તેમાં રફણતા પ્રાપ્ત કરે એવા તો અપવાદી હોય. અનેક જન્મોથી અભ્યાસ કરતાં થોડો અભ્યાસ અધૂરો રહી જયો હોય તેને પૂર્ણ કરવા જન્મ ધારણ કરેલો હોય, છ કે સાત અંગ પરિપૂર્ણ કરી લીધાં હોય, માત્ર એક-એ અંગ જ બાકી રહ્યાં હોય તેવી સીધો અભ્યાસ કરી શકે, એ સિવાય સીધો અભ્યાસ થાય અંધી?

ધ્યાન અધ્યાત્મયોગનું સાતમું અંગ છે. આચળ વર્ષીને એ જ સમાપ્તિ થઈ જાય છે. સમાપ્તિ એટલે મનુષ-જીવનની પરિપૂર્ણતા, પૂર્ણશાંતિ, પૂર્ણસમાપ્તાનનો જેમાં અનુભવ પ્રાપ્ત થાય છે એવી એક સ્થિતિ, આત્મસાક્ષાત્કાર, પરમાત્મસાક્ષાત્કાર. એ કંઈ સીધિસીધો ન થાય. આપણે ડોક્ટર કે એનિલનિપર થદું હોય તો પાણ જેકદે એકથી શરૂઆત કર્યો પડે છે; કેટલા માસ્ટરો, સ્નેહીઓ અને મિન્નોની સંદ્યાયતા વેવી પડે છે. અજીવાન પ્રાપ્ત કરતાં કરતાં ધીર ધીર ડોક્ટર કે એનિલનિપરની ઉચ્ચી મેળવાય છે અને પછી તેની પ્રેક્ટિસ કરીને તેમાં સિલ્લ પ્રાપ્ત થાય છે. તો, આ તો આધ્યાત્મિક લાઈનમાં પાણ આગળ પહોંચાં વધતાં છેવટે પોગમાર્જમાં આપવાનું થાય છે. એવા પોગમાર્જનું સાતમું અંગ જે “ધ્યાન” તેની ચારે બાજુ ફરિયાદ ઊઠી રહી છે કે અમે આપ કરીએ છીએ, તેમ કરીએ છીએ તો એ અમને ધ્યાન નથી વાગતું, ધ્યાન નથી થતું. ધ્યાન જાગે જ નહીં. આ તો સીધું જ મેટ્રિકમાં કે બા. એ. માં બેસવા જેવી વાત થઈ!

મારી ઈચ્છા છે કે હું વડાપ્રધાન જન્મ, વડાપ્રધાનની ઈચ્છા પાણ મને વડાપ્રધાન જનાવવાની છે; મને વડાપ્રધાન

જનાવી ખુલ્લો પર પાણ બેસાડી દીખો. પાણ તેરી શું? પછી કારોબાર કેવી રીતે ચલાવવો? જે જોઈએ વડાપ્રધાન તરીકે મને તૈયાર જ ન કર્યો હોય તો શું બણે? નામમાત્રાનો વડોપ્રધાન, જિનઅનુભવના કારણે ખુરથી ઉપરથી અધ્યાત્મ હેકાઈ જયો. આપણીએ ઈચ્છા હોય ધ્યાન કરવાની અને કોઈ સંતનિયે ઈચ્છા હોય ધ્યાન કરવાવાની, તો એટલાથી જ કંઈ ધ્યાન થઈ જતું નથી. બનેની ઈચ્છા હોવા ઉપરાત ક્રમપૂર્વકનો આંદં અભ્યાસ હોવો જોઈએ; વર્ષો અને જન્મોની ધીરજ હોવી જોઈએ. જેમ રોજ નારું-ખારું, નોકરીએ જરૂર એ સહજ-સવભાવ થઈ જવો જોઈએ. ઇણની ઈચ્છા રાખા સિવાય અને કંટાળા સિવાય એકખારું મરી પડવું જોઈએ; તો સાખનામાં ટકી શકાય. ખારે ઇણ મળે એવી વાલચું રીતે સાખના કરે તે સાખનામાં ટકી જ શકે. સાખના એ તો હિન્દ્યાનું-જીવનચ્યારું એક અંગ થઈ જારું જોઈએ.

બીજુ વાત એ નક્કી કરી લેવાની છે કે આપણે જે જોઈએ છે તે કોની પાસે છે? ધારો કે આપણે ઘડં જોઈએ છે તો પ્રથમ તો આપણે જમે તે પ્રકારે, ચોક્કસપાળે એ નક્કી કરી લેવું જોઈએ કે જે જતના ઘડં આપણે જોઈએ છે તે કોની પાસે છે? તેની પાસેથી પ્રાપ્ત કરવાની વાત તો પછી આવે છે. એ એની પાસે હોય જ નહીં અને એ કેવળ અભિનય જ કરતો હોય તો જમે તેટલાં વર્તો અને જમે તેટલા જન્મો આપણે શ્રમ કરીએ, નિરશા જ મળવાનો. ધ્યાનનું પાણ જોવું છે. જેઓ ધ્યાન વિષે કંઈ જાણતા જ નથી તે આપણને ધ્યાનની રીત આંધી આપવાના હતા? પ્રથમ વાત જે છે કે આપણે જે જોઈએ છે તે, આપણે જેમની પાસે જઈએ છીએ તેમની પાસે છે કે નહીં તે નક્કી થઈ જારું જોઈએ. બસ, પછી ચિંતાને શ્રોદી કારણ નથી. પછી આપણા અધિકાર પ્રમાણે આપણને જરૂર મળશે. પછી, તો તેમનો જતાવેલો અભ્યાસ આપણો હિન્દ્યાનો ક્રમ થઈ જવો જોઈએ. બીજાને પ્રાપ્ત થયું અને મને હજુ કેમ પ્રાપ્ત નથી થતું જેવું અધીર ન ચાલે. બીજાનો અધિકાર પણ હજુ હતો, તોણે જ્યા જન્મમાં પચાસ પ્રાપ્ત કરી લીધા હતા તેરી હવે તેને પચાસ જ પ્રાપ્ત કરવાના બાકી રહ્યા હતા; અને તેંબુદ્ધ જ પ્રાપ્ત કર્યા હતા તેરી તારે અજ્ઞાતું બાકી હતા. જેને અતિ અભ્યાસ જ પ્રાપ્ત કરવાનું બાકી લીધો તે આપણા કરતાં પાઢ્યણથી અભ્યાસ શરૂ કરે તો એ આપણાથી આગળ નોકળી જાય.

तो, प्रथम ऐ नक्की करवानुं रह्युं के आपणे वे जीठिये छे ते, लेनी पासे आपणे नहीं छाए तेनी पासे छे के नहीं। एक वापत नक्की यही जय के ला, तेमनी पासे छे ; तो पछी समर्पण, पछी आपणे वधु मगनमारीनी कांઈ बद्र नहीं। पछी तो तन-मन-धन, विचार-वाणी-वर्तन भयुं व अपीण-समर्पण, 'जे कांઈ याय ते साचा भेदे' ऐवो बुद्धियो उच्चन अतीत करी नामवानुं। अपीराई नहीं, इनी अपेक्षा नहीं।

आपणे ऐवा पाणि विचार आये के आपणे अधिकारी न होइये तो य बुद्धि-संतो तो शक्तिशाली छे ने ? तो, तेओ आपणे तरत अधिकारी केम बनावी न हे ? लेमके -

श्रीकृष्ण अर्हुनने विराटभूपुरानुं दर्शन करायुं थनुं। अर्हुननी तो लापकी न लती, तेने तो चर्मचलु छतां, चर्मचलुयो गे विराटभूपुरानुं दर्शन करवामां आये तो ते कही जय, तेथी श्रीकृष्ण अर्हुनने दिव्यचलु आपां अने पछी विराटदर्शन करायुं। कृष्ण अर्हुनने विराटदर्शन करवावा दृच्छे छे लार पहेवा तेने ऐवो तेयार करे छे केते ये दर्शनने गोली शडे, ग्रहण करी शडे, समझ शडे, मस्तकमां समावी शडे, तो, आ प्रमाणे संतो आपणे तेयार केम न करे तेवो प्रश्न याय, आवो ज्ञतज्ञतनी दबीवो उडे, ज्यां दबीवो, शंकाओ अने शाश्वार्थ छे त्यां साक्षात्कार नहीं। साक्षात्कार केवण समर्पणमां छे, एक वापत नक्की यही जय के आपणे वे जीठिये छे ते अमुक वजिं पासे छे पाच्ची तेमना तरफ केवण समर्पणलाव, कही शंका नहीं, शाश्वामां ऐवो स्थितिने अव्यविचारिणी भजिं कही छे, सावेज पाणि शंका उठे तेना तरफ नो प्रेम घटवा लागे अने तेशी तेनाथी छेटा रेखवा लागोगे, जे वस्तु लेनी पासेथी प्राप्त करवानी छे तेनो संपर्क व तूटी जय, तेमनी पासे व न नहीं तो पछी कांઈ प्राप्त याय व आंखी ? अस्तु,

विराटदर्शननी वात आगण चकावीओ, अर्हुन श्रीकृष्णने लेम भगवान मानता लता तेम बीज धागा भया तेमने भगवान मानता लता, अर्हुननी सावे सावे ते लयाने पाणि श्रीकृष्णे केम विराटदर्शन न उरायुं ? कारासुके दिव्य चलु माटे केवण अर्हुन व अधिकारी यो लतो, अधिकार विना दिव्य चलु पाणि कही रीते आपां ? अति लोचा प्रकारनी समनागु तमने गोने आपवी लोय पाणि तेने तमे ग्रहण करी शक्षे एटवो तमारी ग्रहणशक्ति व न लोय तो ते समनागु तेमारामां रेइवो

कही रीते ? अत्तरो तो भावन छे अने वे भावन अक्षरनी अंदर रहीने व, वे भावन अक्षरोना माथ्यमधी व, वे भावन अक्षरोनी भद्रारनुं अनंत गायुं व्यक्त करवानुं छे अने समजपवानुं छे, तेथी समनागु पढे व उक्ती रीते ? ते भाटे ले लेटवो अधिकारी तेने ते रीते तेपार करवामां आवतो लोय छे, तेपार करनार आपणे कही कांઈ कहेता नवी के वु तमने तेपार करी रही छुं अने तेपार धतो लतो लोय तेने भवर पडती नवी के वु तेपार यही रहो छुं, एकडो धूटां धूटां आउते मेडिंगमां आती जया तेनी भवर पाणि न पढे एटवो स्वाभाविकताथी संतो आपणे तेपार करता लोय छे, सो-सोना अधिकार प्रमाणे तेने तेओ प्राप्त करता जता लोय छे, लेम ऐक्यियामां बेटेवो विद्यार्थी धोमे धोमे आगण वयातो लतो लोय छे, तो कोई व-पांय वार नापास थतो लोय छे, तो कोई साव अभाग रही लतो लोय छे, तो कोई नापास धवायी निराश वहीने भाववानुं छोडी ढेनो लोय छे, आमां पाणि आयुं भयु भनतुं लोय छे, धान जे कांઈ सहेवी वात नवी के अे कोईने तरत शीघ्रवारी देवामां आये अने अे तरत तेपार यही जय, धान तो सातमुं अंग छे, 'धान' आपतां सुधीमां तो अष्टांग-पोग पूरो यही जय छे.

धारणा छहु अंग छे, वितने शरीरेना अमुक प्रदेशमां स्थिर कही देवुं तेनुं नाम धारणा, धारणामां ऐकतानता यही लवी सेनुं नाम व धान, वितनुं कोई एक प्रदेशमां अंगन करी देवुं, कोई एक प्रदेशनो आशरो वहीने तेमां ने तेमां व रममाण उरवुं; मन एक प्रदेशमांथी लागोने ओङ्किसमां जय, लेरा-छोकरामां जय, विपयोमां जय, रमतमां जय, आमां जय, तेमां जय, तांची पाणि लावीने निवित प्रदेशमां चोटाईओ; धडीक तेमां चोटे अने वणी पाणि लागे, वणी पाणि लोय ए प्रदेशमां चोटाईओ, आवो स्थिति ल्यारे आवती लोय ल्यारे तेने पाराणा कहेवामां आये छे, अने ल्यारे मन अपांय कोई लज्जाओ भागे नहीं, ज्यां चोटाई लोय त्यां चेकान थहीन चोटेवुने चोटेवु व रहे गेनुं व नाम धान छे, अने अे धान अतिशय गाव याय ल्यारे तेने व समाप्ति उडे छे छ, ज्यां जिवकुल पवननी अवरज्ञवर न लोय त्यां प्रजटावेवो दावो केवो सुस्थिर रहे छे ! एक वासाणमांथी बीज वासाणमां तेलनी भार करता लोईभे तो ते धारकेवी आंख रहे छे ! ल्यारे धारणा निवातदीपसम अथवा तेवभावत धवा लागे ल्यारे तेनुं व नाम धान छे.

ध्याननी नीछ व्याख्या कि “ध्यानम् निर्विपक्षमनः” - मनने विषयरहित करी नामवुते नु नाम ध्यान छे, आ व्याख्या प्रमाणे विचारीने तो अनु मन विषयरहित छे ? सो ध्यान करवा बेसी लक्षणे छाँजे, तो शु आपानु मन निर्विपक्ष थयु छे ? विषयरहित ध्या माटे तो आपडी मोटी सापेना करवानी छे, आ आप्सो असंज्ञयोग ऐटवा माटे ज छे, अदिसा, सत्त, असत्तेक, ग्रहणवर्य अने अपरिकृष्ट; आ पांच उपांगो यमना अने शीश, संतोष, तप, स्वाध्याय तथा ईश्वरप्रणिधान; आ पांच उपांगो नियमनां, यम-नियमनां आ दसे उपांगोने सिद्ध करीने पछी आसन आवे, ओषधामां औषुं दोह-ले क्लाक स्थिरपाणे बेसी शक्कीने पछी ग्राहणाम आवे, पोग सिद्ध करवानु अति उपरोक्ती अंग छे ग्राहणाम, भूम कठिन, यम-नियमो पाका न कर्ता होय तो ग्राहणाममां लाय नंभाय नहीं, ग्राहणाम सिद्ध कर्ता पाकी प्रत्याहार, इन्द्रियोनां मोरां ले बदारनी भाकु भुव्लां लतां ते अंदरनी भाकु भुव्लां थही गया, इन्द्रियो पदेवां भदारथी आहारने ग्रहण करती लती, लवे ते अंदरथी आहारने ग्रहण करती थही गही, तांन अविनिरुद्धी आहारने, नाक चुनंधृपी आहारने, श्वस स्वादृपी आहारने, चामडी रुप्तवृपी आहारने अने आंग दफ्टिरृपी आहारने बदारथी ग्रहण करे छे, इन्द्रियोनां मोरां भदार भुव्लां छे तेथी भदारनु ग्रहण करे छे, अंदरथी भुव्लां थाय त्यारे अंदरनु ग्रहण करे; तेनु नाम प्रत्याहार, आहारने पाणी वाणी देवो अधीत, ले दीते ग्रहण करे छे तेथी ऊबटी दीते ग्रहण करे, प्रत्याहार पछी ग्राहणाम आवे अने ग्राहणामां परिपक्षता तेनु नाम ध्यान छे, ध्यान आटवुं कठिन छे, ते कांઈ सहज प्रकल्पी प्राप्त न थही जाय, घरेतु कठिन छे तेथी कांઈ आपाणे निराश यवानी ज़रुर नदी के “ओ हो हो ! आमां तो आपानु जम ज नहीं, आमां तो आपाणे सहज थही न अोर्धी?” लेबो सहज थया छे ते कांઈ बेचार मासमां थही गया छे ? घरे ! अन्यारे आपाणे ले भोतिक स्थितिमां, भोतिक उन्नतिमां छाँजे ते कांઈ बेचार भिजिनामां थही गही छे ? आपाणां मातापिता केवा स्थितिमां लतां, केटवुं भागेवा लतां, केवा ग्रामजामां रहेतां लतां, घरना संस्कार केवा लता ? आपाणे तेमनी नीछ पेही तेथी आपाणने थोडा वधु सुमारा अने शोभोनो लाल भज्यो, तेथी थोडी वधु भोतिक उन्नति करी शक्या, आपाणा मोटालायानी पेहीने तो ध्रुणा ओषधा भोतिक लाभो भज्या लता, आम, केटवा जन्मो

अने केटवा पेहीनो पछ्या, अने आपाणे पाण जन्म फारागु कर्ता पछ्या आं आं राहता-रवउता आ स्थितिमां छाँजे, अने जो आमां पाण सवेव क्षयाच के गढबत करीने तो पाणा इकाई लक्षणे, घरेतु ले, भीवाने पकडीने रहे छे - ले दाणाओ घंटीना भीवानो आश्रय करीने रहे छे, ते घंटीना ले पड वच्चे उभार्ह जता नदी, लोगे आध्यात्मिक वाईन लीधी छे अने सद्गुरुनो-संतोनो आश्रय लीधी छे तथा तेमोना प्रत्यक्ष अने परोक्ष उपदेश प्रमाणे ज योतानु छवन जनावी नाम्बु छे अने पाणी कडी भोतिक अवनति पाण नदी आवती, तेओ तो थीमे थीमे आध्यात्मिक उन्नति तरह आजग वरपता ज जाय छे, अस्तु.

ध्यान मालाकठिन छे तेथी कांઈ आपाणे निराश नदी थही जवानु, आपाणे ले करवानु छे ते विषे जो आपाणुने साची मालिती लोय तो आपाणे पूर्ण तेथारी करी शक्कीने, घरम अनाजनी बरेवी कोठीओने बतावीने माझे दोकरीने कहुं के आ बायु अनाज तारे दणवानु छे, आ सांबणीने दोकरी तो लरेशी गर्छ, त्यारे माझे कहुं के, अड हिव्से नहीं, रोल पान्से-पान्सेर करीने बायु दणवानु छे, मीमा कमधी लेम लक्करी माझ अनाज दणाई जाय छे तेम रोलना अस्यासाची मालाकठिन कार्यो पाण पूरा थही जाय छे, एकडो-बगडो घूरता लोहीजे छ्याँजे न्यारे अवो विचार आवे के मारे घेन्युआट धवानु छे तो लरेशी गर्छीने, एकडो-बगडो-तगडो करतां करतां सो चुम्ही अने एक जोक पोराण उरतां करतां घेन्युआट अने उबल घेन्युआट अने पाणी शानविवानी लाईन लहीने तेमां पाण पारंगत थही लक्षणे छाँजे, आ बायु आरे करी शक्या ? जो एकडानी शरुआत करी तो, मालाकठिनमां कठिन लोय तो पाण “करतां अल करोजियो” - जो साचा संत आपाणा उत्थमां आवी जाय, तेमनी साची ओणानागु थही जाय अने पाणी अमेने मूडीने नहीं तो गमे त्यारे पाण मूण स्थानने प्राप्त करीने ज रहीने.

ध्यान विषे भूब प्रश्नो थाय छे, घरेतु अमे आवा कठिन विषयो उपर अरोरेक ज लोबांने छाँजे, पाण अभिकार न लोय तो लरेशी जवाय, आने ऐटवा माटे भोवी रक्षा छीजे के भदार चारे बानु आ विषे ले प्रचार चाली रक्षा छे अमां तमने पाण कांઈ जम घरे, भदार तो अनन्त प्रभारना पाणंदो चालता लोय; अमां आपाणे केटवा पाणंदोनु समाधान करी शक्कीने ? आपाणे तो आपाणी लाईनदी ज जाम, आजुबानु ज यतु लोय ते भवे थाय, तेथी आपाणे शु ? आपाणे आपाणी लाईन

પાડી કરી હોય તેથી આજુભાજુ ગમે તે ચાહતું હોય તે આપણામાં ધૂસે જ હેઠું? જે લઈન પાડી ન હોય તો ઘરીમાં ખા ધૂસે અને ઘરીમાં તે ધૂસે. અહીંથી શાહ્દપુર સુધી ચાલતા નજું હોય તો પચ્ચાસ ડગલાં ચાલીએ એટલે એક ધ્વનિ શાંભળીએ. થોડા આગળ વધીએ ત્યાં બીજે ધ્વનિ સંભળાય. થોડા આગળ વધીએ ત્યાં કોઈ પેલ-તમાશા, નટ-નાટક, તોફાન-મસ્તીનાં દશ્યો આવે અને આપણા મગજામાં ધૂસે. પણ જે આપણું લાઈન પાડી થઈ ગયેલી હોય તો મગજામાં બીજું ધૂસવાની કોઈ કરણા જ ન રહી હોય.

તો આમ, આ રીતે સાચી સમજાગુને પહેલાં પ્રાપ્ત કરવાની છે; સાચું ઝાં પહુંચું છે જે પહેલાં સમજવાનું છે. અને તું વખત સાચું સમજાઈ જણું પછી તે સમજાગુને અને સમજવનારને સમર્પિત થઈને રહેવાનું છે. પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી. વિવેકાનંદ રામકૃપગુની કેટલાય સમય સુધી પરીક્ષા કરી હતી કે તેઓ જુદુ થવાને યોગ્ય છે કે નહીં. પરીક્ષા લેટલી કરવાની હતી એટલી કરી લીધી પછી પત્તી જણું. પછી તો એમની સાથે એવા એકાકાર થઈ જાય કે રામકૃપગુની કેન્સરની ગાંધીમાંથી જે પણ નોકરણું હતું તે પાણ પીવા તેથાર થઈ જાય! આપણે આવું કાંઈ કરવાનું નથી. આ તો એક દફ્ફાં છે. તે વખત તેવું થયું હશે કે કેમ તે પાણ નારાયાન જાણે. અમુક વાતને સચોટ રીતે સમજાવવા માટે પાણ અતિશાળોજિ થતી હોય છે. આખી નિરંદ્રિય સુધી કાર્ય પરીક્ષા કરવાની નથી હોતી. મેટ્રોફ્લેમાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ આવેલા વિદ્યાર્થીની પાણ નેપાંચ વર્ષ પછી પરીક્ષા લઈએ તો એ નાપાસ થાય. જે પરીક્ષા પહેલાં આપ્યો હતો, અન્યારે તો તેનું તરવાના જ યાદ હોય. છોતરાં-દીતરાં કાંઈયાદ નથી રહેતા. પરીક્ષા કરવામાંથી કુશળતા હોવી જોઈએ. વિદ્યાર્થી લોઈએ ત્યારે તો પરીક્ષા લેવાવાળાને પરીક્ષા લેવી છે અને વિદ્યાર્થનિ પરીક્ષા આપવી છે. જ્યારે સંત અને નિરજાસુ એ બેમાં તો નિરજાસુને, સંત યોગ્ય છે કે નહીં તેવી પરીક્ષા કરવાની ઈચ્છા છે. પાણ સંતને ખરાં નિરજાસુની પરીક્ષામાં લેસવાની ઈચ્છા છે? તેઓ ખરાં કહે છે કે તમે મારી પાણે આવો. તેથી જે પરીક્ષા કરવાની વૃત્તિ હોય તો પાણ કુશળતા રાખવી પડે. નહીં તો પરીક્ષા કરતાં મોટો દ્રોષ કરી જેસીએ; બેલાનપણે, અણિષ્ટપણે વતાણી અને તેથી સંતોને મનમાં ઉડી

ઉડી પાણ જે દુઃખ થાય તો આપણાને તેમની મહારોદ લાગી થાય.

અમારા એક સ્નેહી છે. તેઓ મહાકુશળ છે. તેઓ એટલા નામ બુદ્ધિશાળી કે પોતાના આપા પ્રદેશમાં વખાગ્યાઈ જયેલા. પેસો પ્રાપ્ત કરવા માટે જુદા જુદા હુન્નરો પ્રાપ્ત કરવામાં તેમણે કાંઈ બાકી ના રાખ્યા, તો ય તેમની પાસે પાંચસો રૂપિયાની મૂઢી ન થઈ. બચપણ, જુવાની અને જુદાપાં સુધી મથતા રહ્યા અને અનેકોને, અનેક પ્રકારના હુન્નરો અને કણાઓ હીંખપણી દીધાં. તે સો પેસાદાર થઈ જાય. પરંતુ તે સ્નેહી પાસે કાંઈ પેસો ન થયો. તે જ પ્રદેશના એક સંતપ્રેમી દાદા તેમના વિષે કહેતા કે “એ ભાઈને કોઈ સંતનો દ્રોષ લાગી જાયો હોવો જોઈએ. નહીં તો આવો બુદ્ધિશાળી! આપણે લેની સલાહ લઈએ તેની આવી રિયનિ! સાવસામાન્ય મનુષ્યો પાણ તેમની પાસેથી કણ થીયોને ઘરનાં મકાનો બનાવોને બેસી જાય અને એમની જાહે પાંચસો રૂપિયા પાણ નહીં! કષો ના કષો પાણ તેમને કોઈ સંતનો જરૂર દ્રોષ લાગી જાયો હોવો જોઈએ.” આ તો એક દાટાંત આપણું. એટલા માટે કે આપણે પાણ કોઈ સંતનો દ્રોષ ન લાગી જાય એ પ્રમાણે કણખ્યા વહું જોઈએ. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે આપણા સમાધાન માટે, શાંતિ માટે, મનુષ્યખ્યવનની સાર્વકરતા કરવા માટે. કોઈ સાથે આપણે વાદવિષાદ, હારણીત કે શઠસંગ નથી કરવો. આપણે તો સંસંગ કરવો છે. સંસંગમાં તો કેવળ આનંદ જ હોય. અસ્તુ.

આજાલ ધ્યાનનો જે પ્રચાર થઈ રહ્યો છે - જે રીતનું ધ્યાન થઈ રહ્યું છે અહીં એ ધ્યાનની વાત નથી. અત્યારે જે ધ્યાનની વાત છે તે અષ્ટાંગયોગનું સાતમું અંગ છે. આગળનાં છ અંગોને પરિષ્કર કરીને ચાત્રમાં અંગમાં પ્રવેશાય. લાલમાં જે ધ્યાન થઈ રહ્યું છે, જે ધ્યાન કરાવાઈ રહ્યું છે તે પ્રકાર આગળનાં અંગોને પડતાં મુક્કીને સીધો જ સાતમા ‘ધ્યાન’ નામના અંગોને અભ્યાસ છે. ધ્યાન કઠિન છે કોમ કરી રહ્યા છીએ તે અષ્ટાંગયોગનું ધ્યાન છે. સૌપીસીયો જ ધ્યાનનો અભ્યાસ કરી શકે એવા અધિકારી અતિ અલા હોય છે. તે કઠિન છે તેથી આપણે પ્રાપ્ત ન કરી શકીએ એમ નથી. પહેલાં પાણ ‘ધ્યાન’ ધારાને સિદ્ધ કર્યું હતું, લાલમાં પાણ ધારાને રિદ્ધ કર્યું છે અને હવે પછી પાણ ધારાને સિદ્ધ કરશે.

આમ ચિન્હારીએ તો આપણે ને કાંઈ કાર્યો, કર્મો આપાના દિનચર્યામાં કરીએ છીએ એ કાંઈ ધ્યાન વગર થઈ શકે નહીં, એકેબેંક ભાવભરમાં ધ્યાન રામતું જરૂર પડે છે. અમે ને કાંઈ ખોલ્લી રહ્યા છીએ એ ધ્યાનપૂર્વક ખોલ્લી રહ્યા છીએ, એ એમાં બેધધાન થઈ જઈએ તો અમારે ને ખોલવાનું છે તે ખોલ્લી શકત્તા નહીં. તમે સી ને કાંઈ સાંભળી રહ્યા છો તે એકધ્યાન થઈને સાંભળી રહ્યા છો. એ તમારું ધ્યાન બીજે બેધધાન તો અમારું જોવેલું જરાખર સાંભળી શકો નહીં. આ પ્રમાણે સચારથી સાંભળું આપણે ને કાંઈ કરીએ છીએ તે ધ્યાનમય થઈને ન કરી શકીએ છીએ. આ દાખિએ જેતાં સચારથી સાંભળું આપણે ધ્યાનમય ન રહ્યો છીએ, છતાં પણ હાવમાં કહેવું પડે છે કે ધ્યાન કરો, ધ્યાન કરો, શા માટે કહેવું પડે છે? ધ્યાન તો થઈ ન રહ્યું છે. એ ધ્યાન કરવાનું ઉદ્દેશ્યાં આવે છે અને ને ધ્યાન અનાયાસે થઈ રહ્યું છે તે બંને લિન્ન છે.

ને ધ્યાન અનાયાસે થઈ રહ્યું છે - ને ધ્યાન દિનચર્યામાં કરીએ છીએ તે બહિરૂભાસી તે વનતે આપણે બહારના પદાર્થોનું ન ધ્યાન કરીએ છીએ, તે ધ્યાન આપણે ઇન્દ્રિયોના બહારનાં મોદાંઓનો વિપ્લયોગ કરીને ન કરીએ છીએ, ને ધ્યાન કરવાનું ઉદ્દેશ્યમાં આવે છે તે અંતરૂભાસ ધ્યાન છે. દિનચર્યામાં અનાયાસે થતું ધ્યાન બહિરૂભાસ છે અને પ્રાણપૂર્વક કરવાનામાં આવતું ધ્યાન અંતરૂભાસ છે. અંતરૂભાસ ધ્યાનથી આપણો અંદરનો હિય-અલોકિક ખજાનો જોવાનો પ્રકાલ કરવાનો છે. આંખ બહારના જગતને જીવે છે, કાન બહારના જગતને સાંભળે છે; એ પ્રમાણે દરેક ઇન્દ્રિય પોતાપોતાના બહારના વિપ્લયોનું ગ્રહણ કરે છે - બહારના વિપ્લયોનો આધાર કરે છે. પરંતુ જ્વારે પ્રાણપૂર્વક ધ્યાન કરવામાં આવે છે ત્યારે તેમાં ઇન્દ્રિયોને બહારના વિપ્લયોનો આધાર છોડાવીને તેમના મોદાંને અંતરૂભાસ કરવાનાં છે, તેમના મોદાંને અંદરથી ખોલવાનાં છે કે નેથી ઇન્દ્રિયો અંદરનો અનુભવ વહી શકે. 'પિંડ સો ભ્રષ્ટાડી અને ભ્રષ્ટાડી સો પિઠે' એમ કહેવાય છે. પિંડમાં ને કાંઈ છે તે વિચાર અનુભૂતિ પિંડમાં છે. ઇન્દ્રિયોને અંતરૂભાસ કરવાથી પિંડમાં ને કાંઈ છે તે સધારું ચૂલ્હાંથી પિંડમાં છે. ઇન્દ્રિયોને અંતરૂભાસ કરવાથી પિંડમાં ને કાંઈ છે તે તેનો અનુભવ થાય છે અને તેથી આપણા ભ્રષ્ટાડાનો અનુભવ થાય છે. કારણકે સંપૂર્ણ પ્રલાંઘ

ચૂલ્હાંથી પિંડમાં પરબાળેલું છે. ઇન્દ્રિયોની બહિરૂભાસી સમસ્ત બહારના જગતનો જ્ઞાન નહીં આવી શકે કારણકે તે અનંત છે. અભિય પ્રક્રષ્ટાંદમાં ને કાંઈ છે તે જાણવાનો સહેલો ઉપાય એ છે કે પિંડને આપું. અને પિંડને જાણવા માટે ઇન્દ્રિયોના અંદરના મોદાં ખોલવાં પડે, પ્રત્યાખાર કરવો પડે. આ રીતે અભિય પ્રક્રષ્ટાંદનો અનુભવ આપણે આપણા ધરમાં બેઠા બેઠા ન કરી શકીશું. અસરાજ્યોગનું ધ્યાન કઠિન છે પણ એનું ફળ મહાન છે.

કૃદરતનો એક નિયમ છે કે એક બરાય તો બીજું ખાલી થાય, નેમકે એક ખાલી લોટાની દવાને બહાર કાઢી નાખવી હોય તો એમાં પાણી ભરવું પડે. ખાલી લોટામાં પાણી રેઝવા માંડીએ, તો નેમ નેમ તેમાં પાણી ભરવું જાય તેમ તેમ દવા બહારનીકણતી જાય, તેની ન રીતે, તેમાંથી પાણી બહાર કારોબાર લારે, નેમ નેમ પાણી બહાર નીકળતું જાય તેમ તેમ દવા લોટામાં ભરાતી જાય, ઇન્દ્રિયોને બહારની અને અંદરની, બંને પાણું મોદાં છે. આંખોને ખોલ્લીએ છીએ ત્યારે તે તેનું બહારનું મોદું છે, ત્યારે તે બહારના જગતને જીવે છે. પણ તેને જે બંધ કરી અંદર જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તેનું અંદરનું મોદું જૂલે છે. આ બેમાંથી આપણે ને કરવું હોય તે કરી શકીએ છીએ. બહારનું મોદું બંધ કરી દેવાથી અંદરનું મોદું આપોઆપ ન જૂલી જાય છે અને અંદરનું મોદું બંધ થઈ જવાથી બહારનું મોદું આપોઆપ ન જૂલી જાય છે.

ને ધ્યાન કરવાનું ઉદ્દેશ્યમાં આવે છે તે અંતરૂભાસ છે. અને અનાયાસી સાંભળું ચૂંચીની દિનચર્યામાં અનાયાસે ને ધ્યાન થાય છે તે બહિરૂભાસ છે, બહારના વિપ્લયોનું છે.

પ્રથમ તો આપણે શાની શોષે કરવાની છે? નેમની પાસે આપણે જઈએ છીએ તેમની પાસે આપણે ને જોઈએ છે તે છે કે નહીં? તે મારે ઘડણનું દાર્શન આપ્યું હતું. આપણે ઘડું જોઈતા હોય તો નેની દુકાને તે વેવા જવા છીએ તેની દુકાને છે કે નહીં? તે વેવાની તો હોતે કાઢી રહ્યો છે કે મારે ત્યાં જાણવામાં જારી થઈ છે; તેણે પેપરોમાં ખૂબ જાહેરાત પણ આપ્યો છે, તેની દુકાને મોદાં મોદાં ખોડ્યા જવાયેલાં છે અને તેથી આપણે તેની દુકાને ઘડું વેવા જવા. હવે આપણે શું નક્કી કરવાનું છે? તેની પાસે ઘડું છે કે નહીં? એ નક્કી થઈ જાય કે લા, ઘડું છે તો પછી દરે એ જાણવાનું છે કે ઘડણની ડિમત શું છે? તે ડિમત આપણે આપ્યો શરીરને છીએ કે નહીં તે પાત ત્યાર

पछी आवे छ. सर्व प्रथम तो ए जागतानु छे के तेनी जाहेरातो मुक्ति तेनी पासे धडं छे के नहीं. आटली बाबी जाहेरातो करवा छतां तेनी पासे जे धडं न लोय, ए वेपारी जे पाखंड न करतो लोय तो आपाणे धडं अंगांधी मणवाना लता? आजी निंदगी के धार्णा जन्मो आपाणे तेनी पाइण दृष्टि कीजे परंतु तेनी पासे ज्ञ जे नस्थी ते आपाणे आपे कठी रीते? तो, प्रथम तो आपाणे ए नक्की करी वेवानु छे के लेने लां आपाणे धडं वेवानो प्रथल करी रत्ता छीजे - आपाणे एम समज रत्ता छाँजे के आनी पासे धडं छे ते सानु छे? आ एक महान्मनी बाबत छे, त्यार पछी भीज बाबत.

छापामां जाहेरातो वांची, हुक्कन पर लगेलां बोई लेया के अही चारामां सारा धडं भये छे; अने तेवी आपाणे नी हुक्कने जया. जर्तानी साथे अथवा तेनी साथेना थोडा दिवसला, के थोडा महिनाला, के थोडा वर्षोना परिचय पछी आपाणे अनु नक्की धर्यु के धडं तो आनी पासे नस्थी. तो पछी आपाणे शुं करवुं? आपाणे आधात लाजो, धारो समय तेनी पाइण वेडळाई जयो लोवाथी धारो मीटी आधात लाजो. आपाणे निराश थाई जया, नासीपास थाई जया अने तेमांधी गुरुसो प्रगट्यो अने वेर वेवानी वृनिजानी. अही न सावधान धर्य लवानी जरूर छे. चाहे अल्प समय पछी के चाहे दीर्घ समय पछी जबर पडे के आनी पासे धडं नस्थी, जस पती जयुं; तेवी नस्थी तो आपाणे निराश धवानु, के नस्थी तो आपाणे उदास धवानु, के नस्थी तो आपाणे तेनी साथे वेरवृत्ति राखवानी. जे वेर वेवा आपाणे प्रवृत्त वर्षीजे तो धारो जाहो समय एमां न चाल्यो जय, मनुष्यनाम आपाणे आटला माटे लीयो उतो? कोईनु वेर वाजवा माटे समय जरबाद करवानो उतो? भाई! इवाणी हुक्कने आनु भोई चढावेलु छे पाण ए मागेस पाणंदी छे, एनी हुक्कने धडं नस्थी माटे कोई नस्थी नहीं, आम तेनो प्रथारकरवा, तेने उदाढो पाउवा लायमां ठो लहजे इस्ता इरीजे तो आपाणा डिमती समयनु शुं? शुं आवा मुख्लक काममां मनुष्यनामनो समय जरबाद करवानो छे, गुमावी नाभवानो छे? ना. ज्यां आपाणे जबर पडी के तेनी पासे धडं नस्थी कोट्ये पती जयु, धडं भये छे एवां बोई धारो हुक्कने वजावेलां उतां. एमांधी एक आ हुक्कन तपासवानी मटी जही, पछी भीज लज्जाजे. लां अनु अे, तो पछी नीज लज्जाजे. पेवाने उदाढो पाउवा तेना तरक वेरवृत्ति राखानी तेने त्रास आपाणा

आपाणे आपाणो समय जरबाद करवानो नस्थी, समयनो ओटो जय न करतां आपाणे ए जेईने छे ते माटे ही प्रथल-पुरुषार्थ शुरु करी देवानो छे. आ तो एक स्थूल दासांत छे, तेनी हुक्कने नवुं अने धडं भांगवा अने तेले धडं भतावा तेथी जबर पडी के तेनी पासे धडं छे, पाण धडं ने बहवे बानरी के नुवारईत्यादि जतावे तो एनी तो आपाणे जबर पटी जय. आ स्थूल वातोनी तो जबर पडे छे पाण ले सूक्ष्म वात - लेनी पासेथी आपाणे योगविद्या शीभवी छे, लेनी पासेथी आपाणे ध्यान शीभवु छे, ध्यान कठी रीते लागे तेनी कुणा आपाणे लेनी पासेथी प्राप्त करवानी छे - ते नवुं तेनी पासे छे के नहीं एनी जबर कठी रीते पडे? आ तो सूक्ष्म वस्तु छे, एनी तो आपाणी पासे कोई कस्तोटीये नस्थी.

परमात्मानी आपाणे कुदरती बक्षिश छे के अमुक समयना संसर्ग अने परिचय पछी कोई एवी अंतःस्फुरणा, कोई एवी प्रेरणा द्वारा आपाणे जबर पडे छे के ले विद्या माटे आपाणे आ संत पासे आवीजे छीजे ते विद्या तेमनी पासे छे के नहीं. एवी जबर पडवानो समय सो माटे जुदो जुदो नक्की धयो लोय छे. अमुक भाईने अमुक समयमां जबर पटी जय, तो जीज भाईने एटवा समयमां जबर न पडे; तो जीज भाईने ओशो समय लागे. कोई ले मनुष्यना परिचयमां आपाणे आवीजे, एक महाबुद्धिशाली छे अने जीज महामूर्ख. बाध देवावधी तो जने जराबर लागे छे पाण परिचयसी आतरी धर्य जय छे के एक बुद्धिशाली छे अने एक मूर्ख. पाण आ जबर लेटवा समयमां आपाणे पटी तेनाथी जीजने वायु समय पाण लागे अने जीज ओशो समय पाण लागे. अंतःस्फुरणानु अंतरिक निषायें कोनु तेवा प्रकारनु छे तेना पर आ वात अवलंबित छे. वेवेके भोई जबर जरूर पडे छे. अन्तु.

पहेली वात, ध्यान सहेलु नस्थी, भीज वात, सहेलु नस्थी इतांप्राप्त नस्थी धर्यु एम नहीं. भीज वात, सवारथी शांज सुधी आपाणे कुदरती रीते न ध्यान करता लोटीजे छीजे इतांप्राप्त ध्यान करो - ध्यान करो" एम शा माटे कुदेवामां आवे छे? जीटवा माटे के कुदरती ध्यान धाय छे जे जलिमुख छे, ए विषयनु ध्यान छे, अने ले ध्यान प्रथलपूर्वक करीजे छीजे ते अंतमुख ध्यान छे, ते अंतर्गतनु ध्यान छे, योथी वात, लेनी पासेथी आपाणे ए ध्याननी विद्या प्राप्त करवानी छे तेनी पासे

ते छिके नहीं, तेना माटे सावधान करेयानु छे, वही ध्यान वो सातमु भेज छे, प्रथमना हस उपांशो अने छ अंगो परिपूर्ण ध्या पछी सातमु 'ध्यान' छे, ध्यानमां ददवानी प्राप्ति ऐटवे रहापि, जो आपाग्ने ध्यान बागवा मांड़नु, जो आपागे ध्यानमां स्थिर थहर शुभ्रा तो अस्टंगयोज आपागे प्राप्ति करी लीझो, शुभ्रानु बनी शके ? सर्व सामान्य मनुष्य आनु ध्यान करी शके ?

ध्यानमां ले सोधेसीधा ध्यानमां नेचाउपामां आये छे तेनो हु उपयोजिता छे ? तेना माटे ऐम कही शकीओ ते अस्टंगयोजनु ले ध्यान, आध्यात्मिकतानी लिचामा लिची शोटीउपी ले ध्यान, तेमां लवा माटेनो आ पागु ऐक प्रयत्न, कोइपागु वस्तु प्राप्ति करवा माटे अभ्यास अने देवाम्ब लकड़ी छे, लेने चाही भाषामां कहीओ तो ते तप छे, तप विना काँઈ ल प्राप्ति थतु नयो, अधिकारी न होइये छतांय आगणना छ अंगोने छाईने सीधा ल ध्यान करतानो प्रयत्न करीओ छीओ - लेमके आंझो नेप करीने पवाही चालाने नेरीने ले काँઈ प्रयत्न करीओ छाईने - अस्टंगयोजनु सारु ध्यान प्राप्ति करवानु तथा सारु ध्यान प्राप्ति करवनार तप छे, सीधेसीधा ध्यान ने आ रीते आपागे तपकही शकीओ, ध्यानउपी तपकरतां करतां ल्यारे तरानो अमुक लक्ष्यो आपागी पासे भेजी थहर जप, पुण्यनो अमुक लक्ष्यो ऐकही थहर जप ल्यारे सत्पुरुषोनो मेषाप थहर ल्यानो पाग प्राप्ति थाप छे, ध्यानमां आपागे ले काँई लोकित उन्नति करी छे ते शाना कारणे कही छे ? संकर्मो तथा तप लाये कही छे, ध्यानमां ले सोधेसीधा ध्यानमो प्रयत्न थहर रखी छे तेने आपागे तपमो जागाही शकीओ परंतु भेत्री लूक तो न करीओ के पूछाही चाही, आंझो नेप करी ले रीते आपागे भेत्रीये छीओ तेने ल अस्टंगयोजना ध्यानमां प्रवेश समक्ष लहीओ, जो तेमां प्रवेशीये तो संभूति समाधान प्राप्ति लोप, पछी मननी, वित्तनी के वृत्तिओनी बाहरीठ लोप ल शानी ? ऐक लज्याएधी खीछ लज्याए भटकपानी मनोवृत्ति थाप ल झाँचो ? 'मने ध्यान नयो थतु' ऐधी इतिहाद कोइये कोइने करवी ल धा माटे परे ?

तो आम, ध्यान विषे ले काँई वकुमां वापु करेयानो प्रयत्न झाँचे ले ऐटवा माटे के लिचासु सांक भराजर सावधान थहर जप, कोइने उतारी याउपा माटे के कोइनी निंदा करवा माटे आ वात नयी करेयामां आवी, आ वात ऐटवा माटे कही रहा

छीओ अने सांबली रहा छीओ - वांची रहा छीओ के तेथी सावधान थहर लवाप अने महामूली मनुष्यजनन्म ओणे न जाय, साझो कहे छे के शोधाशी लाल लग्नो पछी मनुष्यजनन्म प्राप्ति थाप छे, मनुष्यजनन्मनी सार्वकाता आनंतिक शुभ प्राप्ति करवामां छे अने आनंतिक शुभनी प्राप्ति योग दारा ल संभवे छे; अने ध्यान गे योगनु ऐक अंग छे, आपागे ध्यान बाबतमां ले सारु समक्ष लाई छे अने नील लिचासुओने समाधानानो प्रयत्न करीओ, परंतु ले ऐम भानीने लेहा छे के अमे ले काँई करीओ छीओ ले सारु ल छे, अमने भीकुं काँई शीजवानी ईच्छा ल नयी अना माटे जोटो आचरण राखीओ, तेनो साये शहस्रंगमां के विवादमां ल दाखलादलीवामां उतरीने आपागो समस भरणाद न करीओ, आपागु पासे चाही उत्सोटी आवी यही छे, लेना पाग संपर्कमां ले पाग प्रविद्वितिमां आवीओ नारे तेने ते उत्सोटीधी रखीओ, संतोओ कहु छे ने के, 'सार सांको छही रहे, योधा हाये उत्ताई !'

ध्यानमे आनुपांगिक वातोने विस्तारपूर्वक करेयामां आवी, विशिष्ट अजिता प्रतिष्यमां ले लिचासुओ ले तेने पाग आवी वातो उपचित ल सांबलाया मणती लोप छे, आपागे ले काँई सांबलणु छे तेने भूल चारी रीते समजवानो अने उपनमां उतारयानो तथा साचा लिचासुओने लेट आपेहानी प्रयत्न करीकु ती अमाहु भोवेकु तथा तमाङु सांबलेकु सार्वक थशे, अमाहु भोवेकु ऐटवे ते अमाहु पोतानु थीकु छे ? अमने पाग अहेतुकी इपावाणा परोपकारी सहजनो लाया ते प्राप्ति थहर लही, अमाहु पोतानु काँई छे ल नयो, योगदर्शनमां परंपरावि छे के 'अथ योगानुशासनम्' ऐटवे के 'अमे योगशासनं अनुशासन आगी रहा छीओ, आमां अमाहु योगान नयो, ले योगशास अमे कही रहा छीओ ते अमने परापूर्वी आगणना आगामो लाया मणेकु छे ते तमने कही रहा छीओ,' आरे अमे ले काँई कही रहा छीओ ते अमाहु पोतानु पराक्रम नयो, ते अमागी योगानी शोप नयो, जो तो अमने उपर्यो लेट मणां अमाहु छे ते अमे तमने आपी रहा छीओ, आम प्रत्याग अपत्यस्त्रपे अमने पाग इपावाणा ले काँई प्राप्ति थहर छे अने अदृश रंगेलपेकु छे तेने तमारी समक्ष मुक्यानो प्रयत्न थहर रहो छे, अने एमां पाग लेना भाग्यमां केटहु लही तेटवु तेने

આતપૂર્વક સાંભળ્યું હતે. ને સાંભળેણું છે તેને મળતામાં બરાબર ચોટાઈ દેવું જોઈએ. જે એમ લાગે કે ભૂલી રહ્યું એમ છીએ તો નોટખુકમાં લખી લેવું જોઈએ. નહે કોઈ સ્તોત્રોનો કે શ્લોકોનો રોજ પાછ કર્યો છીએ કે કોઈ મુદ્રાનો-મહિલાની જાખતને રોજ પાછ કરતા રહ્યો છીએ તો એક કાળ એવો આવે છે કે તે વધુમાં બરાબર ચોટી જાય છે. પછી તેનું કંઈ વિસ્મયાળ થતું નથી.

#### : એકાશતાપ્રાપ્તિના થોડા ઉપાયો :

ઘણા બધા સાધકોની જે ફરિયાદ છે કે ધ્યાન નથી વાગતું, એકાશતાનો આનંદ નથી અનુભવાતો, તે માટે થોડા સ્વાનુભવપુઅ ઉપાયો નીચે રાનૂં ધ્યાન છે.

(૧) ચાર-પાંચ મિનિટ અર્ધ-નાર્યાગાસન કરવાથી પ્રાગ્નપ્રવાહ ભલ્લાંથે તરફ વહેતો થઈ જાય છે. પછી તુંલ ધ્યાનમાં નેસવાથી એકાશતાપ્રાપ્તિના સફળતા પોડે છે.

(૨) સતત દશ-પંદર મિનિટ જાગવી મંત્રના વાચિક અપ કરીને પછી માનસિક અનુભૂતો જારી રે બધા અક્ષરોને અનુભૂતે જીવાનો પ્રથળ કરવાથી પાણ અચાનક જ એકાશતાની ભૂમિમાં સરી જવાય છે. અભ્યાસના પરિપક્વ કાળે બધા અક્ષરો વિદ્યુતવત દશથિ છે. વિદ્યુતના અક્ષરોથી લાગાયેલો હોય તેવો આખો મંત્ર હેલાવા લાગે રે સ્વિન્ન ધ્યાણી સારી છે. એ વખતે વાચિકિદ્વિદ્યુતની અમિત્તતા થઈ હોય છે. તે સ્વિન્નિને 'મંત્રદ્વા' ની સ્વિન્ન સરનાવી શકાય.

(૩) સતત દશ-પંદર મિનિટ સુધી વાચિક દીર્ઘ પ્રાગ્નથી ચ્યાર-કરીને ધ્યાનમાં નેસવાથી પાણ એકાશ નાલદી થઈ શકાય છે. અ... ઉ... પછી મ આવે ત્યારે બંને લોઠ નંબ થઈ જાય છે. જો બંનું સ્વિન્નિમાં જ પ્રથાસ પૂરો જાય ત્યાં સુધી ગુંજારવ કરતો. જાસ પૂરો થઈ જાય ત્યારે અ... ઉ... અને મ ની બીજી આવૃત્તિ કરતો. જો પ્રમાણે દશપંદર મિનિટ ઓમની વાચિક અપ કરીને ધ્યાનમાં નેસી જવાથી સફળતા સારી મળે છે. એ વખતે બંનું હોણ્ણી 'મ' નો ગુંજારવ ચાલતો હોય છે તારે મેરુદ્ધમાં ચૂલ્માતિચૂલ્મ જોવા હિંદુ કંપનો-સંપદનો જાય છે કે જેનાથી સન્ધર્યાંનમાં અને વિદ્યુતપ્રવાહમાં વુલ્દિ થઈને ભલરંગ ગુંધી પદોચેલ ચુપુમજા પ્રભાવિત જાય છે. તેથી દીર્ઘ એકાશતાની પ્રાપ્તિ જાય છે.

(૪) કોઈ કોઈ ગુરુસંતનિષ્ઠાયુઅ સાધકો પોતાના વીતરાજ ગુરુસંતોમાં એવો અન્યાભિયારિણી નિષ્ઠા-ભજિત રાખતા હોય છે કે તે માત્ર તેનાથી જ એકાશતાની સફળતા પ્રાપ્ત કરી બેના હોય છે. એવા દિવિ નિષ્ઠાભજિતનો ઉદ્ય કાઈ સીને થબો સહેલો નથી. તેના માટે જાત જગતને ગત જન્મોના સંસ્કાર અને સુકૃતનો જાયો થબો જરૂરી છે. એવા સંનિષ્ઠ સાધકો પોતાના વીતરાજ ગુરુલનોની તીવ્રતમ પાદમાનથી વીતરાજ થઈને એકાશ થઈ શકે છે. ને વખતે ગુરુદેવની તીવ્ર યાદનો ઊભરો શિથના ઝાંખાએ ઝાંખાએ સુધી પ્રચરી જથો હોય છે ત્યારે તેને સ્પર્શ કરતારને તથા તેની આસપાસ ધ્યાનમાં નેસે છે તેને ધ્યાન વાગવામાં, એકાશ થયામાં સહાયતા મળે છે. એ વખતે સદગુરુની તીવ્ર યાદનો ઊભરો એટલો જેશદાર હોય છે કે ને ચૂકમુખે શરીરની જાલાર નીડળાને વાતાવરણમાં ફેલાય છે. તેની અસર વના ઝોડા પ્રમાણમાં આસપાસના બધા જવો ઉપર જાય છે. પોતાના ગુરુલનો સાથે પ્રેમના તારથી અદેલ ચાંપી ચૂકેલા આવા જાચા શિખો-સાધકો જરૂરલે જ હોય છે. તેમને સાથી રાતે ઓળખાં કેવા રે પાણ મહાલાયની નિશાની છે.

#### ગુરુનિષ્ઠાનું બીજ

ગુરુનિષ્ઠાનું બીજ સૂક્મ સ્વરૂપે બચપાણથી જ અજિતમાં લાલાર હોય છે. બીજા કાળે તે પરિષક થઈને અલોકિત શાણાંતા બને છે. તે વિષે અમારો એક સ્વાનુભવ લગ્નાવોએ. અમે ગુજરાતી શોચ પોરાગમાં ભાગતા જ્યારનો એક પ્રસંગ હુંચક છે. અમારા હરિશંકર માસ્તરે, કે નેઓ થોડા સમયથી બાદારણમથી આવેલા તેમણે, આજા વર્જના વિદ્યાર્થીઓને પ્રથળ કર્યો કે આધ્યાત્મા આજા વર્જમાં વધુ હસમુખો વિદ્યાર્થી કોણું છે? તેઓ પોતે ખૂબ હસમુખા સ્વભાવના લતા. તેથી અમે જિલ્લા થઈને ડરાં ડરાં કલું કે વધુમાં વધુ હસમુખો તું છે.

અભ્યાસમાં અમે ખૂબ મંદ, ખૂબ રમતિયાળ સ્વભાવ હેર આપેલું વેસન ઝર્ણા વિના નિશાને જાય. વેસન નહીં કરવાના કારાગે માસ્તરે સાથળમાં ખૂબ ચોટિયા ભર્યા, નેથી સાથળમાં લોંબા ચક્કામાં ઊપર્યો આચાં. અમે હેર જાય. પિતાની તો નોકરી અંધે બલારગમ લતા. તેથી મોટા બાપા કેશવજી બાપાને

ચોંકાની વાત કરીને લોલાં ચકમાં બતાવાં. કેશવજી બાપા પૂર્ણ ભક્તકોટોનો જીવ, તોથ લોલાં ચકમાં જેઈને ઉકળી ઉઠ્યા, તરત જ તેમણે માથે પાથડી મૂડી, કસોચાળું કેળિયું પહેણું અને લાયમાં લાડડી લઈ અને મને કહે, 'આદ નિશાળે'. ખુંતેમનો લાય પકડીને દોરીને નિશાળે લઈ ગયો. તેમણે માસ્તરને શાંતિધી કહ્યું કે 'હરિલાલ! છોકરાના બાઘમાં ભાણવાનું હોય તો ભાગશે, પાણ ભાગાવવા માટે આવા ચોંકા બરો તે સાંદું ન રહેવાય'. ભસ, આટલું કહીને અમે પાણ ધરે વળી નીકળ્યા.

ભાણવામાં સાવ મંદ, કારણકે ભાણવામાં રસ જ નહીં. છતાંથી ચોથા ધોરણમાં મૌહનલાલ માસ્તર અમને વર્ગના મોનિટર બનાવેલા. તેમણે અમારામાં મોનિટર તરીકેની લાયકાત જોઈ હોય. માસ્તર પોતે ખૂબ થાંત પ્રકૃતિના. તેમની ગેરલાજરીમાં એક તોકાન કરતાં છોકરાને શાંત કરવા કદાચ અમે તેને ટપવી મારી હોય. માસ્તર આવ્યા પછી તે છોકરાએ અમારા વિષે માસ્તરને ખૂબ ફરિયાદ કરી. માસ્તરે તેને તોકાન કરવા બદલ હપકો આપવાને બદલે ઉપરથી એમ કહ્યું કે 'મોનિટરે તને થપ્પડ મારી છે ને? તું તેને થપ્પડ બગાન.' તે છોકરો તો થપ્પડ મારવા અમારા તરફ ધસ્યો અને નજીક આવીને પૂરણેશથી અમારા જાલ ઉપર એવો તમારો બગાન્યો કે ઘરીક તો અમને કાંઈ દેખાનું નહીં, પછી લાલપીણાં દેખાયાં અને કાનમાં સમૃ... અવાજ ગુજુલ રહ્યો, ધોડી વાર પછી કાનનો અવાજ બંધ થયો અને આંખોથી દેખાવા લાગ્યું. એ વાનતે માસ્તર સાહેબ અમને સંણોધીને કહી રહ્યા હતા કે 'અરે! તું તો સાવ મૂર્ખ છે, પેલો લાઢો મારવા આવે છે તોથ થાંભલાની નેમ સિયર થઈને ઊભો રહ્યો છે! એ વાનતે મોહું આધુંપાણું કરીને તેનો લાઢો ચુકાવી દેવો જોઈએ ને?' મને લાઢો પણ પછી માસ્તરને પાણ ખૂબ ખૂબ દુઃખ થયું હોય તેમ લાગ્યું.

તે છોકરાને તો અમે રમતમાનમાં ભોંયે લેગો કરી દઈ શકીએ તેમ હતા. અમારું શરીર ખાંચું બળવાન હતું. પરંતુ જ્યારે અમારા માસ્તરે જ જુરુજુએ જ અમને લાઢો મારવાનો પેલાને આદેશ આપ્યો પછી અમારાથી તેનો લાઢો ચુકાવાય કેમ? લાઢો ચુકાવવાનો વિચાર પાણ કેમ કરાય? માસ્તર સાહેબના આદેશ મુન્ઝબ લાઢો ખાઈ જ વેનો જોઈએ ને? અમારા મનમાં આવા જાંસ વિચારો ચાલતા હતા તેની ખબર જિચારા માસ્તર

સાહેબને આંથી હોય?

આ પ્રસંગથી, સુધ્મ ગુણિધાંબીજ કેવી રીતે અને આરાથી કામ કરું હોય છે તેનો આધો ભાલ આવી શકે છે. અસ્તુ.

### આશાચક પર માખી

અમારે આ પ્રમાણે બનતું. ધ્યાનમાં બેસીએ કે એક માખી જમે ત્યાંથી આવીને મસ્તક ઉપર ગમે નાં બેસી જાય. મસ્તક ઉપરથી ધીમે ધીમે કૃપાળ ઉપર આવે. કૃપાળ ઉપર આધીપાછી થઈને છેવટે બે નોંધોની વચ્ચે - આશાચક ઉપર આસન જમાવી હે અને પોતાના પણ થોડા થોડા આધાપાછા કરતી રહે. ત્યાં માખીના પગનો સ્પર્શ થતો રહેવાથી મન-ધ્યાન નોંધો વચ્ચે જ રહ્યા કરે. થોડી વાર પછી માખી પોતાનું ડલનગલન સંપૂર્ણ બંધ કરીને સિયર થઈ જાય. એ વખતે અમે પાણ સંપૂર્ણ સિયર થઈ જાય હોઈએ. માખી નયારે નોંધો વચ્ચે આવે નહીં ત્યારે એવા વિચારો આવે કે નોંધો વચ્ચે કોઈ ચોકાનો પદાર્થ લગાવીને માખીને ત્યાં ચોંટાડી દેવી જોઈએ, જેવી માખીનો થોડો થોડો સ્પર્શ ત્યાં થયા કરે અને તેથી વૃત્તિ સતત આશાચકમાં રહ્યા કરે. પાણ તુરત જ વિચેકલુંદિ તેમ કરવાની સાખત ના પાડે અને એવા પોટા વિચારો, બીજી જવને વાસ આપવાના વિચારો ઉપર ખૂબ તિરસ્કાર વરસાવે.

પરંતુ આ માખી-પ્રકરણથી આમ વિચારીને આનંદ અને સમાધાન થતાં કુદરત આ રીતે ધ્યાનમાં સલાહતા કરે છે. ચુમાલીસમા સુત્રમાં કહ્યું છે કે સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતા જેએ સંબંધ થાય છે, તો આ રીતે ઈષ્ટ દેવતા સલાહતા નહીં કરતા હોય તેમ કહી શકાય?

આ પ્રકરણથી બીજું પાણ એક રહસ્યોદ્ઘાટન થતું કે નોંધોની વચ્ચે તિલક કે ચાંદલો કે બીજું જ કાંઈ ચિકલ કરવામાં આવે છે તે પ્રારંભ અવસ્થાના સાધકોને ધ્યાનમાં સલાહતા કરવા માટે જ કરવામાં આવે છે. કરાણું તેનાથી નાં કાંઈક ચોંટયું છે તેવું લાગ્યા કરે અને ત્યાંની ચામડી પાણ જરા જરા બેંચાળા કરે તેથી વૃત્તિ તાં રહ્યા કરે, તેથી એ નક્કી થયું કે બે નોંધો વચ્ચે જ કાંઈ ચિકલ, જ પ્રકારે પાણ કરવામાં આવે છે તે ધ્યાનમાં સલાહતા પદ્ધોચાડવાનો એક પ્રકાર જ છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસે ન્યારે પૂર્ણ કે ધ્યાન જાં કરતું

ત्वारे तोतापुरीએ એક કાચનો ટુકડો છૂટો મારેલો, એ રામકૃપગુણનાં નોંધો વચ્ચે લાગેલો અને થોડો ધા થઈ જાયેલો. પછી તોતાપુરીએ કર્યું કે ધ્યાન ત્યાં (નોંધો વચ્ચે) કરવું, આ પ્રસંગ પણ શુદ્ધ છે, અસ્તુ.

ધ્યાનાવસ્થામાં કોઈ વાર તો એવું પણ બનતું કે શરીર ઉપર માઝી બેઠી હોય તેને પહુંચા દીવાલ ઉપરથી જરોળી કૂદકો મારીને શરીર ઉપર પડે અને ચમકાવી હે ! આરેક માઝી અને અમે પરસ્પર હોય ચડીએ, માઝી કષાળમાં બેસે અને અમે કષાળની ચામડી લાંબી-નીચી કરીને તેને ઉત્તરી દઈએ, તે પછી તુરત ત્યાં આવીને બેસી જાય, અમે ફરી પાછા ઉડાડીએ, પછી અમને એવા વિચાર આવે કે આ વખતે આવીને બેસે ત્યારે ઉડાડવી ન નથી, સહન કરી લેવું છે, તો તે વખતે તે આવે ન નહીં.

(૫) દશ-પદર મિનિટ દીર્ઘ શાસોશાસ કરીને પછી ધ્યાનમાં બેસી જવાથી પણ સારી સફળતા મળે છે, એ વખતે “સમંકાયકિરોચીન” રહેવાનો પ્રયત્ન કરવો અથવા આસનમાં બોઢા હોઈએ ત્યારે શરીર, જરદન અને મસ્તક વાગે સમરાપવાં, જરદારા રાજથાં, મસ્તક, કે જરદન, કે શરીર વળી જાયેલું - જુદી જાયેલું ન હોતું જોઈએ, અસ્તુ.

### આરોહ-અવરોહનુક્ત ધ્યાન

મન-ચિત્ત અતિ ચંચળ છે, તે ન મનન કરે ત્યારે મન, ચિત્તન કરે ત્યારે ચિત્ત, નિર્ણય લે ત્યારે બુદ્ધિ અને હ્યાતીની પ્રતીતિ વખતે અહંકાર કહેવાય છે, બુદ્ધિશાળી તે છે કે ને મનની ચંચળતાને લક્ષમાં લઈને તેની લેટે કામ લે, મન સ્વભાવથી ન ચંચળ છે તેથી તેનો સ્વભાવ બદલાવી નહીં શકાય, તેથી મનને અસ્થિર તો થયા ટેવું પણ તેની પોતાની ઈચ્છા પ્રમાગે નહીં પણ આપણો ઈચ્છા પ્રમાગે, આપણે નક્કી કરેલા સ્થાનમાં, નેમકે -

એ પહેલવાનો છે, બંનેમાં સમાન શક્તિ છે પણ એકમાં બુદ્ધિ વધુ છે, બંને કુસ્તીમાં ઊતરે છે, ઓછી બુદ્ધિશાળી સામાને પછાડવા જાતજાતના દાવ અનુમાવે છે અને ખૂબ શક્તિથી લેટે છે, ત્યારે વધુ બુદ્ધિશાળો બુદ્ધિરૂપક ધીરજથી સામાના દાવને સમજવાનો પ્રયત્ન કરે છે, ઓછી બુદ્ધિશાળાએ વધુ બુદ્ધિશાળાને પછાડવા નોંધો અને ને તરફ આંચકો માણો કે

તે ન વખતે વધુ બુદ્ધિશાળાએ જોવો અને એ તરફ ન આંચકો મારીને ઓછી બુદ્ધિશાળાને બોંધેલો કરી હોયો, પ્રતિસ્પદાની તાકાતની સાથે પોતાની તાકાત બેળવીને આસાનીથી વિનાય પ્રાપ્ત કરી લીધો, ધ્યાનમાં પણ આ રીત અનુમાવીને સહેળમાં સફળ થઈ શકાય છે.

આસનસ્થ થઈને જમાણા પગના અંગૂધાથી ધ્યાનની શરૂઆત કરવી, મન, તેના સ્વભાવ મુલાખ થોડો સમય નાં સ્થિર રહીને બીજે ભાગવા તેથાર થશે, એ વખતે તેને ભાગવા હેવાનું, રેટકવાનું નહીં, નહીં તો મનની સ્થિતિ ખૂબ દબાવેલી સ્થિરેં લેવી થશે, ખૂબ દબાવેલી સ્થિરેં તૂટી જાય છે અથવા છટકે છે, છટકીને ધાયલ કરે છે, મનને તૂટવા પણ ન દેવું કે છટકવા પણ ન દેવું, તેને બીજા સ્થાનમાં જવા દેવું પણ સ્વચ્છદ્વારાં નહીં, આપણા અનુશાસન પ્રમાગે, અંગૂધામાંથી મન ભાગવાની તેથારી કરે કે તુરત પગની ચેનીમાં સ્થિર કરવું, એ ન પ્રમાગે જ્યારે મન અસ્થિર થવાની તેથારી કરે કે તુરત ન સ્થાન બદલવું, પેનીમાંથી પિંડિમાં, પછી હીંચાળમાં, પછી સાથળમાં, પછી વિંગસ્થાનમાં, પછી નાભિમાં, પછી હદ્દસ્થાનમાં, પછી કંદસ્થાનમાં, પછી નાકની આંખી ઉપર, એ ન પ્રમાગે પછી કે કે નીચે ઊતરીને અંગૂધા સુધી આવવું, ધ્યાનનો આ પ્રકાર ખૂબ પ્રભાવશાળી અને નિરાપદ છે.

ધ્યાન વખતે મનની અતિ ચંચળતા

**પ્રશ્ન :** ધ્યાનમાં બેસીએ ત્યારે, સામાન્ય સ્થિતિ કરતાં પણ મન વધુ ભાગંભાગ કરે છે, એવું કેમ બનતું હશે ? તે માટે શું કરવું ?

**ઉત્તર :** તમારી વાત સાચી છે, ધ્યાન વખતે થોડી-થોડી ઓકાગ્રતા થયા લાગે છે ત્યારે એમ ન લાગે છે કે મન ખૂબ ભાગંભાગ કરે છે, પરંતુ છકીકતમાં તેમ નથી હોતું, વધુ ભાગંભાગ લાગવી એ મન થોડું થોડું સ્થિર થઈ રહ્યું છે તેની સાબિતી છે, ધ્યાન અવસ્થા કરતાં સામાન્ય અવસ્થામાં મન ઓછું ભાગંભાગ કર્યું લાગે છે, એ વખતે એવું લાગે છે એટલું ન, ખેરેખરે તો તે વખતે મનની ભાગંભાગ અનંત ગાંધી હોય છે, એ વખતે મનની એટલી નેહદ ચંચળતા-ભાગંભાગી હોય છે કે તેની થોડી પણ નોંધ નથી રાખી શકાતી, તેની ભાગંભાગી આપણી પકડમાં ન નથી આવી શકતી, જેમ કોઈ અતિશ્ય

गतिमान वस्तु स्थिर लागे छे, आंभ तेनी नो॒प लही शके तेटली  
तेनी जति ओँची थाप छे त्यारे लाते जतिशील लागे छे.

ध्यानमांन लोइबेत्यारे मन अनंताच लोय छे, अनंत  
ज्ञानाचे भटकतु लोय छे, तेथी ते नो॒प राजी शकवानी लहनी  
बाहार लोय छे, तेथी तेवा स्थिति आपाग्ने अति चंचण नदी  
लागती, ध्यानमां बेसीचे छीचे त्यारे मन धोमे धीमे अमुआच  
थाप छे, तेनी चंचणताने आपागे लक्ष्मी लही शकीचे छीचे,  
तेनी भागंभागीसे आपागे गणतरीमां राजी शकीचे छीचे अने  
तेथी मन अति चंचण लागे छे, ध्यान वापते मन अति चंचण  
लागे छे त्यारे तो ते स्थितता तरक लोय छे, ओँचु चंचण लोय  
छे, अमुआच थतु थतु मन छिवटे ओकाच थही जप छे, नियमित  
अभ्यासना भवावराथी ने मन लागो स्थानोमां भटकतु थतु ते  
धोमे धीमे दुश्रो स्थानमां अने तेमांधी धोमे धीमे सेंकडो  
स्थानमां अने तेमांधी दो, पचास, पचीस अने दस-पांच  
स्थानोमां आरंने ओकाच थही जप छे, मन न्यारे दुश्रो अने  
लागो स्थानोमां भटकतु लोय त्यारे तो तेनी नो॒प लही व कई  
रीते शकाय? नो॒प लही शकवानी आपागी असमर्थताना कारणे  
मनने अचंचण कई रीते कही शकाय? याग त्यारे ते पचीस-  
पचास ज्ञानाचे रमतु लोय त्यारे तेनी गणतरी आपागे कही  
शकाए, तेनी गणतरी कही शकवानी आपागी समर्थताना कारणे  
तेने चंचण अने अस्थिर कई रीते कही शकाय?

उपरोक्त ध्यान विषयी स्वस्यमय वानो हीर्घकाणना  
अभ्यासथी आपो आप समझाई जप छे.

### माणा ध्यानमां सहायक छे

**प्र१नः** ज्ञप्तकर्ती वापते माणानी थुं नक्तर छे? माणा  
हेववामां मन रोकायेकु रहे छे तेथी मन क्षमामां भराभर ओकाच  
थही शकतु नदी, मने तो माणा विना ज्ञ ज्ञप्तकर्ता माणा वापते  
आवे छे.

**उत्तरः** अनुष्ठानकाणमां ज्ञप्तमेन्द्रो गणताना लोय  
छे तेथी माणानी नक्तर खडे छे, तमो माणा विना ज्ञ ज्ञप्तमां  
स्थिर थही शकता दो तो तमरे माणानी नक्तर नदी, परंतु जेनु  
मन अनंताच, अति चंचण छे तेनो माणा भूम उपकारी छे,  
सहायक छे, ते पाश ओक, ध्याननो ज्ञ प्रकार छे, ज्ञप्त वापते  
मन सतत ज्ञप्तमेन्द्रो तत्त्वान रही शकतु नदी, ओ वापते मन

ओटली रहनवताथी वहेवारमां-प्रपंचमां सरको जप छे ते नी  
जिल्कुब भवार रहेनी नदी, अने पची प्रपंचमां लागेकु मन  
अंते धार्कोने तंद्रानिद्राना ओके यांती जप छे अने तेमां स्वप्नो  
पाग जेवा लागे छे; अने आ रीते असावाना साधकने  
अहोभावमां (!) झूलां भवतावेचे, परंतु ज्ञ वापते जे माणा  
राजी लोय तो आवी स्थिति आववानी संभावना भूम ओँची  
थही जप छे, कारणे के माणा हेस्वती वापते ओकविष्टता तुटी जप  
तेथी स्थितिलतानित तंद्रा-निद्रानी संभावना अतिथय घटी  
जप छे, नेमडे -

मनमां ज्ञप्त यातु छे, ओक मंत्र पूरो याप ओटले  
आंधणीओ माणानो ओक माणाडो हेस्वे छे अने आजी माणा  
पूरी याप ओटले माणाने पवटाववी पडे छे, मंत्र पूरो याप ओटले  
माणा-माणडो हेस्ववानु ध्यान राखतु पडे छे अने माणा पूरी  
याप त्यारे माणाने पवटाववानु ध्यान राखतु पडे छे, आ रीते  
सतत ध्यान थतु रहे छे, भवे ध्यान-स्थान बहवार्तु रहे, जे  
मन तंद्रानिद्राने वश याप के प्रपंचमां बीके लागे तो उपरोक्त  
त्राणे कियाओ इमवान न थही शके, ते भाटे भवाभर जगत  
रहेकु ज्ञ पडे, तो, आ रीते ज्ञप्त वापते माणा भूम नक्तरी छे,  
अस्तु.

ध्याननो रोक प्रथल इस्वो तेनो ज्ञ ओक सङ्काता  
समञ्ज वेवी जेईओ, ध्यान डेनु अने केटलु याप छे तेनी किकर  
भहु न करली जेईओ, अंतरंग सूक्ष्म गतिविधिमानु नाचुं  
तोवमाप शहवुं सरण नदी, बाढी तो सीना मनथी सी सवाशेर  
छे.

**तदेवार्थमात्रनिभासं स्वत्पूर्णमिव समाप्तिः ॥३॥**

**बावार्थः** अर्थमात्र न भासमान याप अने स्वत्पूर्ण  
शून्य थही जप ते समाप्ति.

**विस्तारः** मानसिक ज्ञाटकी ने आइति ओई रक्षा  
छाए ते हये सतत दंगाय छे, वच्ये वच्ये अन्य दशो नदी  
उपसी आपतां, आवो अभ्यास हीर्घकाल, अजंतापागे अने  
सत्कारपूर्वक याली रहो छे, आवा अभ्यासमां हये जेवी स्थिति  
आववा लाजी छे के आइति देखावी साव नेप थही जप छे,  
नदी तो आइतिनु भान रहेतु नदी तो जेवावाणानु, अनेनो  
जप थही जप छे, ते वापते अलीकिक, हिय ओकाचता ज्ञ वनो

રહે છે. તેમાં જ સ્થિર થઈ જવાય છે. તેનું નામ સમાપ્તિ.

આવી સ્થિતિમાં વારેવાર સ્થિર થવાનો અભ્યાસ કરવાથી હદ્દુમાં એક એવા પ્રકારનું સમાપ્તિ ઉત્પન્ન થાય છે કે જે સતત સાચે રહે છે. પછી જીવનમાં વાળ-ધાનિ, સુખ-દુઃખ લેવું કાંઈ નથી વાગતું. તેથી આઠે પદોર અખંડ શાંતિ બની રહે છે.

### સાવધાન

દીર્ઘકાળના અભ્યાસથી એટલી જરૂરી એકાગ્રતા થઈ જાય છે, તદુપ-તનમય થઈ જવાય છે કે પછી તેનું નામ જ નિરોધ-અવસ્થા થઈ જાય છે. તદુપતાના કારણે ‘લેનારો’ અને ‘લેવાનું’ એમ જે નથી રહેતાં, બંને એક થઈ જાય છે. જો ‘લેનારો’ જ ન હોય તો ‘લેવાનું’ કોણ લુંબે? ‘લેવાનું’ જ ન હોય તો ‘લેનારો’ શું લુંબે?

અભ્યાસમાં, તંત્ર-નિદ્રાના કારણે પણ દ્રષ્ટા અને દર્શનો વિલય થઈ જતો જાગ્રાય છે પણ તે સમાપ્તિ નથી. મોટા ભાગના સાધકોને તંત્ર-નિદ્રા છેતરી જાય છે. તંત્ર-નિદ્રા તમોજુણની અધિકતા છે જ્યારે સમાપ્તિ સત્ત્વજુણની. જીવામાં જે કલ્યાણ છે કે “સમેકાય-શિરોચીવ” તે સરસ કસોરી છે. સમાપ્તિ અવસ્થામાં પડ, રોક અને મસ્તક; ત્રાગેય સમ-અવસ્થામાં અથવા એકસીયમાં રહે છે. પડ, રોક કે મસ્તક વળેલાં નથી હોતાં. તંત્ર-નિદ્રામાં આ ત્રાગેયની સમ-અવસ્થા રહી જ નથી શકતી. માટે તંત્ર-નિદ્રાથી જીવનના રહેવાની જરૂર છે.

### જ્યા, પારણા, ધ્યાન અને સમાપ્તિ

જે ઈષ્ટમંત્ર માનસિક વાગ્ની દ્વારા રાતાં રહે તે જ્યા છે; જે દેવનો મન હોય તેની આકૃતિને અમુક દેશમાં જ અમુક સમય માનસિક દસ્તિથી જેવી રે ધારજા છે; તે આકૃતિ માનસિક

દઢિ સતત જોતી રહે તે ધ્યાન છે અને અભ્યાસજ્ઞા પરિપત્ર કાળે તે જ્યાનો જોકી સાચે વિલય તે સમાપ્તિ છે, તેનું જ નામ “તદ્દુદ્રષ્ટ: સ્વરૂપેઅવસ્થાનમુ”.

### સમાપ્તિ વિષે ખોટી માન્યતાઓ

સમાલોચના સમાપ્તિ વિષે અનેક પ્રકારની માન્યતાઓ અને જેરસમનાળો પ્રવર્તે છે. ધ્યાન એમ માનતા હોય છે કે સમાપ્તિસિદ્ધ પાસે ચમત્કારો તો હોય જ, જે ચમત્કારો ન હોય તો સમાપ્તિ સિદ્ધ થઈ છે એમ કદેવાય જ કેમ? પરંતુ સામાન્ય જનમાનસ એ સમજ જ કેવી રીતે શકે કે ચમત્કાર જોવાનું, ભતાવણાનું કે પ્રાપ્ત કરવાનું પ્રલોભન જ ન રહેવું એ કેટલો મોટો ચમત્કાર છે? ખેલખરતો ચમત્કાર અને સમાપ્તિ પરસ્પર વિરોધી છે. તેના માટે યોગસૂત્ર છે કે “તે સમાપ્તાવુપસર્ગ વ્યુત્થાને સિદ્ધયા” . ચમત્કારી અને સિદ્ધિઓ તો સમાપ્તિમાં વિનન છે, સમાપ્તિનો ભંગ છે. જેમાં ધ્યાન, ધ્યાન અને ધ્યેય સુનાં લય પામી જાય છે પછી તેમાં બીજું ચમત્કાર અને સિદ્ધિઓ - રહે જ કાંઈથી? સમાપ્તિયી જલેને જીવામાં જીવા પ્રકારનું સુખ મળતું હોય પણ જો તે ભૌતિક હોય તો તેને દિવ્ય-અલોકિક કેવી રીતે કલી શકાય? સમસ્ત ભૌતિકતામાંથી બહાર નીકળવાનો સ્વાનુભવ કરવા માટે તો સમાપ્તિમાં પ્રવેશ કરવાનો છે.

જગૃત, તંત્ર, નિદ્રા, સ્વર્ણ, સુપુણિ અને મુલ્ય અવસ્થાથી સમાપ્તિ મિન્ન છે. સમાપ્તિને ‘આ નથી, તે નથી, પેંચું નથી’ એમ નિપેશમુખ્યથી કહેવાનો કાંઈક પ્રયત્ન થઈ શકે છે. કોઈ સમાપ્તિસ્થ, સમાપ્તિનું રાર્થન કરવાનો પ્રયત્ન કરે તો તુરત વ્યુત્થાનઅવસ્થા-જગૃતઅવસ્થા આવી જાય છે. તેથી સમાપ્તિ-અવસ્થાના જે કાંઈ વાગ્નો હોય તે સમાપ્તિ અવસ્થાથી ઊતરતી અવસ્થાના જ હોય. અસ્તુ. ઓમ... ઓમ... ઓમ...

## જોગીડા તારી શાલ બહુ કામણગારી

કાચ - રાધવજ્ઞભાઈ બ. પટેલ

પ. પુ. ગુરુદેવે ખરેચાપુરા જામમાં જેમની મેડી ઉપર અમુક સમય પોગસાયના કરેલો અને ખૂબ જીવા અનુભવો પ્રાપ્ત કરેવા તે, શ્રી રાધવજ્ઞભાઈ બહુમાણદાસ પટેલ જાય વર્તે ભૌતિકાનું અભિરોધન કરવાના અમદાવાદ આવેલા, તે વર્તાને તેઓઓ માનસિક રીતે ખૂબ અખાંત હતા; ત્યારે પ. પુ. ગુરુદેવ

શ્રી પોગલિનું તેમની અભર પૂર્ણવા ગયેલા અને તેમને આશ્રિત આપીને શાલ ઓડાડેલી, તેથી તેઓ ઉર્ધ્વિભોર થઈ જયેલા. ત્યાર પછી થોડા દિવસો તેમાં પોતાનો અનુભવ અને ઉમળકો આ “જોગીડા તારી શાલ બહુ કામણગારી” માં ઠાલવાને ગુરુદેવને ચારાં ધોરી, તે દ્વારા સૌને પ્રેરણ મળે એટલા માટે

કાય અહીં પ્રગત કરીએ છીએ, નામડાના એક સૌધા-સાદા જેણું ગુરુનિષ્ઠામાં મસ્ત બનીને કેટલો બધો સુંદર ભાવના રજૂ કરી છે !

### જેગીડા તારી શાલ બહુ કામગુગારી

(આયા છે જોકુણ તારચા છબીલો વાલ.. એ રાગ)

શાલ બહુ કામગુગારી, જેગીડા તારી શાલ બહુ કામગુગારી,  
તને વંદન કરે છે નરનારી, જેગીડા તારી શાલ બહુ કામગુગારી,  
શાલ ઓઢાડી મને આનંદ આપો રે,

મનની વિટેબાળાઓ ટાળી રે, જેગીડા તારી શાલ...  
ખોબલા જેવડા ખડેરાવપુરામાં,

યોગવિદ્યા વિસ્તારી, જેગીડા તારી શાલ...  
યોગસાધના માટે કુટિર બનાવી,

ઉપર પજાફ્ઝકાવી, જેગીડા તારી શાલ...

ઓમપરિવારની સ્થાપના કીની,

લોકલ્ભાગ- બેખધારી, જેગીડા તારી શાલ...

ટાંક તલાવડીમાં સ્નાન બહુ કીનું,

પાવન કર્યું એનું પારિ, જેગીડા તારી શાલ...

શેદ લસમાણભાઈ, મુખી માધુબાઈ,

સેવા કરે છે અનિ સારી, જેગીડા તારી શાલ...

ત્રીજા રવજીભાઈ, ચોથા રાધવજી,

ગામ તાળાં નર-નારી, જેગીડા તારી શાલ...

દેશ-વિદેશના લોક જેને ખોળતા,

એવા મણ્યા જોગો ભલચારી, જેગીડા તારી શાલ...

તારા તે પોગનો મહિમા જાણીને,

રાધવજી જાય વારીવારી, જેગીડા તારી શાલ...

## પૂ. ગુરુદેવ સાથે યાત્રાધામ અંબાજીમાં

-શથીકાંત પટેલ

અમારા કુટુંબમાં મારા માતાપિતાની પહેલેથી એવી ભાવના કે આજા કુટુંબે વર્ષમાં એક વખત યાત્રાધામ અંબાજી જરૂર, માતા-પિતાની ભાવનાને ઠેસ ન પહોંચે તે દેનુંથી, શરીર હોય તાં ચુંચી આ નિયમ પાણવાનો અમે પ્રયત્ન કરીએ, અમે અંબાજી જયાના હોઈએ તારેય. પૂ. ગુરુદેવ ક્રીયોગલિઙ્ગુંજને વિનંતી કરીએ કે જે અનુકૂળતા હોય તો આપ અમારી સાથે પથારો, અને પૂનલક્ષ્ણીને અનુકૂળતા હોય તો પથારે પણ જરૂર.

ગુરુદ્ધારે મારા કુટુંબીજનોની માનસિક સ્થિતિ એવી છે - સો એ વાત સમજે છે કે પૂનલક્ષ્ણીના પરમ પાવનકારી ચરાગુણમાં જ સર્વ તીર્થયાત્રાઓ સમાપેલી છે. સંજેઘોને-પરિસ્થિતિને આખીન યદીને જે બાદરગામ જયાનું થાય તોપણ જે પૂનલક્ષ્ણી સાથે હોય તો જ બાદરગામ જયાનો સાચો આનંદ-ઉત્સાહરાસે છે, નહીં તો માન્ય ઓધ્યાવરિકતા ભાતર જલા હોઈએ તેવું લાગે છે. અસ્તુ.

અમારા કુટુંબના નિયમ મુજબ એક વખત અંબાજી જયાનું નક્કી થયું. પૂનલક્ષ્ણી સાથે આવવાના હતા તેથી મેં નક્કી કર્યું કે હું સંપારે પહેલી બસમાં અંબાજી જરૂરિને સારા, શાંત, સ્વચ્છ અને હવાજીસવાળા ગેસ્ટલાઉસમાં ઉતારાની સંજવડ કરી રાખ્યું અને પૂનલક્ષ્ણી માટે સ્સોઈની પાણ વિવસ્થા કરી નાખ્યું. પૂનલક્ષ્ણી મારા કુટુંબીજનો સાથે મોડી બસમાં અંબાજી આવે.

રહેવા-નમવાની સંજવડ થેણી હોય તેથી તેઓને તકલોફ ન પડે. આમ વિચારીને હું સંપારની પહેલી બસમાં અંબાજી પહોંચ્યો. તાં સ્સોઈની વિવસ્થા કરી ઉતારા માટે જર્યા શોધવા નીકળ્યો. અંબાજીમાં બીડ બહુ તેથી ચારે બાજુ ફરવા છતાં રહેવાની જર્યા આપણ ન મળી.

પૂનલક્ષ્ણીની બસનો આવવાનો સમય થતાં હું બસસ્ટેને પહોંચ્યો. મોડી વારે બસ આવી. બસમાંથી પૂનલક્ષ્ણી અને મારા કુટુંબીજનો ઉતારા. ને પરમશાળામાં મેં સ્સોઈની વિવસ્થા કરી હતી તે પરમશાળામાં અમે સો પહોંચ્યા. સોએ બોજન-પ્રસાદ લીધ્યો. બોજન કર્યા બાદ પૂનલક્ષ્ણીએ મને પૂછ્યું, “ભાઈ, ઉતારાની વિવસ્થા આં કરી છે ? ચાલો તાં જઈને આરામ કરીએ.” મારા પ્રયત્નો નિષ્ઠળ ગણેલા તેથી હું હાશ હતો. મેં ગુરુજીને કશું કે ધારી તપાસ કરવા છતાં હું ઉતારાની જર્યા મેળવવામાં નિષ્ઠળ ગણે હતો. આ સાંભળી પૂનલક્ષ્ણી પાંચેક મિનિટ થાંતિથી નેઢા પછી મને કષે કે -

“બુઝો, ઈને ઉતારા માટે તપાસ કરો. આપણે તો અહીં માતાજીના દરબારમાં થોડા દિવસ આધ્યાત્મિક આનંદ વેવા આયા છીએ. જે આપણે અહીં રોકાઈએ તેથી માતાજીની ઈચ્છા હશે તો સંજવડ મળશે અને તેમની ઈચ્છા નહીં હોય તો સંજવડ નહીં મળે; તો પાછા અમદાવાદ જઈશું.”

अमेर अगाड अंबाळु आवा त्यारे पूलत्री साथे देवा  
प्रभुसदन गेस्टहाउसमां उतरेवा. त्यांनी सगवड अने  
आलुभालुनु वातावरण भूज सुंदर झता; पूलत्रीने पाणी भूज  
घेवा. तेथी हुं अने मारां पल्नी देवा प्रभुसदन गेस्टहाउसमां  
झी तपास करवा गया. गेस्टहाउसना महेताळने मणी अने  
उम माटे पूऱ्यां. महेताळने कहुं के “आलनु बुकिंग करावेल  
याचाणुओ आवा नवी तेथी उभव-इमनी संगवडवाणो उतारो  
आली छे.” अमे उम जेयो. गुरुकृपा! आ उममां न अगाड  
अमे उतर्या झता अने अत्यारे पाणी ते न उम अमने मणतो  
हतो. अमे महेताळने या याडी दीमी अने पूऱ्यां के सात-आठ  
दिवस माटे आ उम मणये? अरागेके अमारे अंबाळुमां सात-  
आठ दिवस रोकाश करवानु लहुं. महेताळने कहुं के “अत्यारे  
तो योवीस क्लाइ माटे आणुं. ऐ बुकिंग करावेल याचाणुओ  
नवी आवे तो वयु दिवसो माटे आ उम आधीश.” अमे उम  
राखा दीमी. परंशाणाचे जई पूलत्रीने लागावृं. सरसामान  
लही, छपमां वेसी अमे यो गेस्टहाउस उपर पाणा आवा.  
उममां सामान जोठवी आराम करवा लाभा.

आराम करतां करतां मने विचार आओ के नवारे  
अंबाळु आववानु नडी थयु त्यारे भारा मनमां एम थयुं के हुं  
अंबाळु घेवो आदी नहुं अने यो अव उतारानी व्यवस्था मारी  
रीते कुं. आवा अहमभाव साथे हुं घेवो आदी गयो. परंतु  
धारी कोशिंग करवा घतां उतारानी व्यवस्था न थरी. आथी धारी  
हताश अने निराश घयो. पूलत्री आगण में मारी निष्फलता  
अने असमर्थतानी कभूलाल करी. आम, अहमभाव सदृतर  
चाल्यो गयो. त्यारपछी प्रथम प्रयासे न वयुमां वयु  
संगवडतावाणी लागा अमने मणी के न्यां घेवां पाणी में तपास  
करी हती परंतु लाग्या मेणववामां निष्फल घेवो. तो, आ प्रसंग  
उपर्यो भुज्य जोयपाठ एवेवानो छे के गुरुसंतो साथे रेवा  
झतां जे मनमां अहमभाव राखीशुं तो कोईपाणी कार्यमां  
आपाशने सहजता नवी. मने, परंतु संपूर्णपाणी तेमनी  
शरागागति स्वीकारीशुं तो अनायाशे अकरवकरमांधी सहजता  
सांपड्यो.

सांने पूलत्रीने शिव अने शक्ति विषे तात्पिक  
समवाय आपतां कहुं के -

“ईश्वर कहो के ईश्वरी कहो, शिव कहो के शक्ति कहो,  
अगवान कहो के अगवती कहो; ते वयुं एक न छे. परंतु लुदा

लुदा देश, काण अने समाजने अनुरूप, जपिमुनिओं  
लोकल्यासु अर्थे परमात्माना लुदा लुदा नाम अने मूर्तिना  
माध्यम द्वारा लोकोंने परम चेतन्य तत्त्वने भजवा प्रेया छे. तेथी  
देश, काण अने समय मुजब ए तत्त्व लुदा लुदा नामे  
ओणभाषु. बाईं नो, ते परम चेतन्यतत्त्व नवी तो खीविंग के  
नवी तो पुलिंग; ते तो छे आशविंगी. तेनो वाचक, तेनु नाम  
ओम छे.”

पूलत्रीना सांनिध्यमां न्यां पाणी लोईमे त्यां  
स्वाध्याय, सन्साग, मंत्रभून, ध्यान वजेरेनो कार्यक्रम नियमित  
थतो न लोय. अे मुलब गेस्टहाउसमां पाणी आ प्रकारनो कार्यक्रम  
नियमित यवा लाग्यो. दररोज गायनीमंत्रनी लयनक धून पाणी  
थती हती. आ कार्यक्रम ने दिवस चाल्यो त्यां तो गेस्टहाउसमां  
क्राम करता क्रामदार भाईओ पाणी क्राम करता गायनीमंत्रनी  
धून लोववा लाग्या. अमे आ वात पूलत्रीने करी. पूलत्री  
कहे के, “न्यारे सान्सांग-भजन नियमित थाय त्यारे ते स्थाननी  
आशपासना वातावरणमां सात्पिक आंदोलनो इलाय छे नेनो  
असर ते वातावरणमां रहेता छ्यो उपर थाय छे अमे तेओ  
पाणी सात्पिक आवयसु करवा प्रेयाय छे.” अस्तु.

मारा कुटुं भीजनो अने हुं गेस्टहाउसना  
भोजनालयमां प्रसाद लेता. पूलत्री माटे पाणी भीडा-मरवा  
वगरनी रसोठी न्यांना भोजनालयमां न बनती. चार-पांच  
दिवसना रोकाश पाणी एक दिवस पूलत्रीने कहुं के “बाई!  
धारा वाखती गालरनो रस योधी नवी. आने तो अमारे  
गालरनो रस योधी छे तो तेनी व्यवस्था करो.” हुं भूजायो.  
मनमां वयुं के रस काढवानु मर्शीनतो छे नवी तो पाणी रस करी  
रीते काहवी?! में आ वात पूलत्रीने लागावी. पूलत्री कहे के  
“ओमां भूजावा नेवुं कांठी नवी. गामां नहीने तपास करो.  
कोई लोटब के ऐस्टोरन्टवाणा पासे मर्शीन लोय तो तेने येसा  
आपीने रस कढवावी लागो.” हुं जामां गयो. त्यां तपास करी  
पाणी मर्शीनतो मेण पज्जो नवी. परंतु तपास करतां करतां एवी  
धारी मणी केनेना उपर इण्ठां छाँगतां इणानी मावा नेवी लूंगदी  
यही अय अने तेने नियोदींतो तो रस नीकणे. में प्रयोग आतर  
योडा गालर लही तेनो रस काढी जेयो. रस बराबर नीकणातो  
हतो तेथी में छाँगी भरीदी दीमी अने योडा गालर लही उतारे  
गयो. उतारे जई रस काढ्यो अने पूलत्रीने आप्यो. पूलत्री  
गालरनो रस योने तुप्प थाया. पाणी कहे के, “दाय! लहे थांति

થઈ."

ઉપરોક્ત પ્રસંગ વાંચીને અમૃત વાંચીને એમ ધાર્ય કે પૂનરશ્રી આગ્રહપૂર્વક અમૃત વસ્તુ આપા કે પોતા માટે શા માટે કહેતા હો ? સંત-છવન ગાળતાં ગાળતાં આવો આગ્રહ શા માટે ? તેમની આ સંકાનું નિવારણ કરવા જાગ્રત્તું કે મારો પૂનરશ્રી સાચેનો અનેક વર્ષાનો સંગ્રહ છે અને તે દરમાન મેં અનુભાવું છે કે તેઓને અમૃત વસ્તુ જોઈશે જી, કે અમૃત વસ્તુ નહીં મળે તો નહીં ચાલે જોનું કાંઈ જ જોતું નથી. તેઓને તો જાળરનો રસ મળે તો ય આનંદ અને ન મળે તો ય આનંદ હોય છે. આરેક શિખ્યો-ભક્તો પાસેથી તેઓ અમૃત વસ્તુનો આગ્રહ રાખે છે તેનું કારણ શું છે ? તેનું કારણ શિખ્યોને-ભક્તોને તેથાર કરવાનું છે. આરેક અમૃત વસ્તુ આપાને પ્રાપ્ત ના યાય તારે આપાને હતાણ ન થવું જોઈએ. આપાને તેને પ્રાપ્ત કરવા માટે પોત્ય પુરુષાર્થ કરવો જોઈએ, પ્રથમ કરવો જોઈએ અને વેકલિયક દીતે જે વસ્તુને પ્રાપ્ત કરવી જોઈએ. આવો જામતા આપાજીનાં આવે તે માટે જુરુસંતો સદા પ્રયત્નશીલ હોય છે. દરેક મનુષ સાચે તેઓ આવું વલાગનન્યો રાજ્યાના પરંતુ તેઓને પૂરેપૂરી આતીરી થઈ ગઈ હોય કે આ મારો ભક્ત બરાબર પાડો થઈ જાઓ છે અને જરૂર તેવી પરિસ્થિતિમાં યણું તે અંકળાઈને મારાંથી દૂર નહીં જાય ન્યારે ભક્તના કલ્યાણ માટે યદ્યને તેઓ દક્ષાંથી આવું વર્તે કરતા હોય છે. અને જુરુસંતો જારે શિખ-ભક્ત ઉપર હક્ક કરે જ્યારે જ તે બરાબર તેથાર થઈ જાય છે એમ કહેવાય. આ જ ભક્તની સાચી પ્રાપ્તિ છે. બાકી, સંતોસે તો શું છે ? સંતની વ્યાખ્યા કરતા પૂનરશ્રી શાંતિ વાર કહે છે કે -

તીન ટૂક કોચિનકો, અરુ બિન ભાણ લોન;  
તુલસી રઘુવર કર બસો, ઈન્દ્ર બાપડો કોન ?

"શંતોની સ્વિતિ આવો હોય છે, તેઓ સમાન વચ્ચે રહેતા હોવાથી સમાજની મરાદા જાળવવા તથા શરીરનું રક્ષણ કરવા માટે વખ્તો પહેલે છે, નહીં કે શોભા વધારવા; શરીરને ટકાવવા માટે ભોજન કરે છે, નહીં કે સ્વાદ માટે. સંતોના દ્વારામાં તેમના આરાધ દેવ બિનાનેલા હોય છે. તેઓ સતત નિજાનંદમાં જ, આત્માનંદમાં જ મસ્ત હોય છે; પરમતાન્ય સાચે વરલીન હોય છે. આવા સંતો પાસે મોટા ધન-કુનેરોની, તેમની ધનદોષતની કે દુનિયાના બૌદ્ધિક યુદ્ધ-સાધની-વેલયની કાંઈ જ વિસત નથી."

સંતોની આવો સ્વિતિ હોવા છતાં તેઓ તેમના વાયક

ભક્તો-શિખ્યો પાસે અમૃત વસ્તુઓની માંગાજી કરે છે; તે એટલા માટે નહીં કે પોતે માંગેલી વસ્તુને પ્રાપ્ત જે અને પોતાની દીચણાને પોતે પરંતુ એટલા માટે કે પોતાના ભક્તો-શિખ્યો એ રીતે તેથાર યાય. અસ્તુ.

અંબાણ યાત્રાયામની નજીક જાખર નામનો પર્વત આવેલો છે. તાં પણ માતાજીનું રથાન છે. યાત્રાજીઓ તાં પણ દર્શનાર્થે જતા હોય છે. એક દિવસ અમે પાગ પૂનરશ્રી સાચે જન્માર ચઢવાનો કાર્યક્રમ જનાઓ. પર્વતની છેક રોચે પહોંચવા માટે વળબગ એક દાજુર પગથિકાં ચઢવાનાં હોય છે. અમે ધીર ધીર આ કપણું ચઢવાનું ચઢીને ઉપર પહોંચા. ઉપર જઈને એક મોટી રિલા ઉપર જી જેઠા. યોડા સમય બાદ પૂનરશ્રીને કણું કે -

"ભાઈ ! આપણે આટલો પરિક્રમ કરીને ઉપર આવ્યા. અમને લાંબે છે કે આ પર્વતનું નામ જાખર છે તે અપણણ થયેલું છે. વાસ્તવમાં તેનું નામ જાખર હોય. જાખર એટલે જણાયું. તો, આ જાખણું-કાખણું ચઢવાનું જાણીને આપણે ઉપર આવ્યા. માતાજીના દર્શન કરવા. અં માતાજીના દર્શન કરવાના છે ? આ જોખમાં જે મૂર્તિ છે તેની દર્શન કરવાનાં છે ? જોખમાં મૂર્તિ મૂર્તી છે તે તો એક પ્રતીકમાત્ર છે. જેનું ? પરમ શક્તિનું. વાસ્તવમાં તો નહીં આ ઊચા પર્વત ઉપર આવીને જે પરમ શક્તિની લીલાનું દર્શન કરવાનું છે. આ દૂર દૂર નજર પહોંચે તાં સુધી કેવાણી જિરિમાળા, વન, ઉપવન, જાડ, પાન, તાણાવ, સરોવર વગેરેનાં દર્શન કરવાનાં છે અને એમ કરીને પ્રદૂતિના સ્વચ્છિતાને મનોમન વંદન કરવાનાં છે."

પૂનરશ્રીની આ લાખાયિકના છે. તેઓ સતત એ વાતનું ધાન રાખે છે કે લોકો પર્મના નામે ફક્ત અંધ્રાદાને જ પ્રાધાન્ય ના આપે. તેથી જ તેઓ સાચી સમજાળના પ્રદાન દ્વારા ધ્રમ સાચે વાગ્યાને સૂદમ આધ્યાત્મિક રહસ્યોને પાગ સમજાવતા હોય છે. એક જ સથાને આપણે અનેક વધત યાત્રા કરી હોય છતાં જે ન જોયું હોય અને ન સમજાયા લોઈયો તે થાં, પૂનરશ્રીના ચાંનિધ્યમાં તેઓની સાચે યાત્રા કરવાથી સમજાઈ આપ છે. આ મારો વર્ષોનો અનુભવ છે.

તો, આ રીતે યાત્રાયામ અંબાણની અમારી યાત્રા સાચા અર્થમાં સફળ રહી. ઓમબગવાનને એવી પ્રાર્થના કે જારીરેપાણયાત્રા કરવે ન્યારે પૂનરશ્રી અમારી સાચે હોય. અસ્તુ.

ओं श्वर का बोधक (नाम) प्रणव/ओम् है।



(समाधिकार के दूसों का भावानुवाद)

- (२४) कलेजा, कर्म, कर्मफल और वासना जिसमें नहीं है ऐसा पुरुषविशेष/चेतनविशेष ओंश्वर है।
- (२५) ओंश्वर संपूर्ण सर्वज्ञ है।
- (२६) ओंश्वर पूर्वकाल के गुरुओं के भी गुरु हैं और काल की मर्यादा से (जन्म—मृत्यु से) पर है।
- (२७) ओंश्वर का नाम प्रणव/ओम् है।
- (२८) अर्थ के चिन्तन सहित ओम् का जप करना।
- (२९) चिन्तन सहित जप करने से अन्तरायों का अभाव और आत्मसाक्षात्कार होता है।

प्राप्तिकारन ओम् वारदात, ११३८ लक्ष्मीनगर, नारायणगढ़-३८००१३।

### ● द्रष्टव्याएः उद्देशो :-

- (१) सर्वव्यापक परम भूक्तम् येतन लक्ष्य के लिये नाम प्रणव (ओम् - औं) छे तेनी प्रतीति अक्षुजनसमाजने कराववा प्रयत्न करवो। (२) 'थोग' लो प्रथार, प्रसार अले संशोधन करवा प्रयत्न करवो। (३) समाजनु नेतिक धोरण ऊंचुं लाववा माटे आच्छालिक ज्ञानो साहित्य छारा प्रथार अने प्रसार करवानो प्रयत्न करवो। (४) आ उपर्यांत 'अक्षुजनहिताय-अक्षुजनसुभाव' ने लगातां कार्यों वेवां के केणवणी, तबीजी सारवार वगेरे करवा माटे प्रयत्न करवो।

## PRINTED BOOK

Registrar of News Papers of India under Regd No. 48770/90



### આધ્યત્મિક તથા આધ્યાત્મિક વડી

### પ. પુરુષેવ શ્રી યોગભિસુજુ

#### PRINTED & PUBLISHED BY :-

Dr. S. S. Bhikshu for  
AUMGURU PREMSAMARPANDHYAMBHIKSHU PARIVAR TRUST  
1/A, Palladnagar Society, Naranpura, Ahmedabad - 380 013.  
Printed at: Kunai Offset, Odhav, Ahmedabad.  
Hon. Editor : Naishadh vyas  
(Reg. No. E/4416 Date 11-5-81)  
I.T.E.U. 80-G (5) No. H.Q. -III 33-163/92-93 up to March 1995

#### લવાજમ દર :-

વાર્ષિક સભ્ય (ભારતમાં)	રૂ. ૧૫-૦૦
આજુવન સભ્ય ( " )	રૂ. ૨૫૦-૦૦
વાર્ષિક સભ્ય (પરદેશમાં)	૧૨ \$
આજુવન સભ્ય ( " )	૧૦૧ \$

#### લવાજમ મોકલવાનું સ્થળ :-

- (૧) ડૉ. સોમાભાઈ એ. પટેલ  
૧/અ, પલિયેન્ડનગર,  
સેન્ટ ગ્રેવિયર્સ હાઇસ્કૂલ રોડ,  
નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૯૩.
- (૨) નૈખદ્યભાઈ સી. વ્યાસ  
"સ્વાશ્રય",  
૩, ગંગાધર સોસાયટી, રામબાગ પાછળ,  
મહેનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮.

#### સૂચના :-

- (૧) લવાજમ ચેક દ્વારા અથવા મનીઓર્ડ દ્વારા  
"ઓ. પ્રે. પ. ટ્રસ્ટ" ના નામે મોકલવું. સાચે  
આપનું પૂરું નામ, સરનામું શુદ્ધ અકારોમાં  
લખી મોકલવું.
- (૨) જે સલ્યનાં રહેઠાણનાં સ્થળ બદલાયાં હોય  
તેમણે તેમના નવા રહેઠાણનું પૂરું સરનામું  
લખી મોકલવું જેથી વ્યાસ્તાપકોને અંક  
મોકલવામાં સરળતા રહે.
- (૩) "એતભરા" ને લગતો પત્રવ્યવહાર નીચેના  
સરનામે કરવો.  
નૈખદ્યભાઈ સી. વ્યાસ  
"સ્વાશ્રય",  
૩, ગંગાધર સોસાયટી, રામબાગ પાછળ,  
મહેનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮.

**પ. પુરુષેવ શ્રી યોગભિસુજુ**  
**સાથેના સંસ્મરણો તથા પ્રેરક**  
**પ્રસંગો આવકાર્ય છે.**

LM-31B NV

NARENDRA R. DAVE H